

# દાદીની પ્રસાદી

માવજીભાઈ મુંબઈવાળા

પ્રાપ્તિસ્થાન:

<http://www.mavjibhai.com>

સુભાષિતોને દિલો-જાનથી

ચાહનારા અને

QUOTABLE QUOTES ના

બેતાજ બાદશાહ

સંસ્કાર પુરુષ

શ્રી સુરેશ દલાલને

સાદર અર્પણ

# દાદીની પ્રસાદી

જેમ આજે આપણી માતૃભાષા ગુજરાતી છે તેમ એક સમયે આપણા પૂર્વજોની માતૃભાષા સંસ્કૃત હતી. એ રીતે જોતાં સંસ્કૃત ભાષા આપણી દાદીભાષા કહેવાય. આ દાદીભાષા પાસે તો જ્ઞાનનો ક્યારે ખૂટે નહિ તેટલો વિશાળ ખજાનો છે. આ અખૂટ ભંડારમાંથી માત્ર ચપટીક પ્રસાદી અહીં રજૂ કરી છે. આ પ્રસાદીને સુપાચ્ય બનાવવા પ્રત્યેક કંડિકાની સાથે સાથે તેના ગુજરાતીમાં ભાવાર્થનું અનુપાન પણ રજૂ કરાયું છે.

## પ્રાર્થનાઓ

અસતો મા સદગમય।  
તમસો મા જ્યોતિર્ગમય।  
મૃત્યોર્મામૃતમ્ ગમય॥

(બૃહદારણ્યક ઉપનિષદ)  
[અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા  
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા  
મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા]

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે।  
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે॥

[ઈશાવાસ્ય ઉપનિષદનો આ શાંતિપાઠનો શ્લોક છે. તેનો શબ્દાર્થ છે: તે પૂર્ણ છે. આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે. પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પણ પૂર્ણ બચે છે. આ શબ્દોનું સૌથી સરળ અર્થઘટન એવું છે કે બ્રહ્મ સંપૂર્ણ છે. બ્રહ્માંડ પણ સંપૂર્ણ છે. બ્રહ્મમાંથી બ્રહ્માંડ પ્રગટ્યું છે અને બ્રહ્મમાંથી બ્રહ્માંડ બહાર આવવા છતાં શેષ બ્રહ્મ સંપૂર્ણ છે.]

ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं।  
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्॥

[આ ગાયત્રી મંત્ર સૂર્ય આરાધનાનો મંત્ર છે. ભાવાર્થ છે: હે સર્વોપરી દેવ ! તું જીવનનો આધાર છે, અમારા સર્વ દુઃખ દૂર કરે છે, તું સ્વયં પ્રકાશિત છે, સૌથી વધુ પૂજનીય છે, અમે તારું ધ્યાન ધરી પ્રાર્થના કરીએ છીએ કે તું અમારી બુદ્ધિને વધુ પ્રજ્વલિત કર.]

ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै।  
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै॥  
ॐ शान्तिः शान्तिः शान्तिः॥

રક્ષણ કરો પોષણ કરો પ્રભુ આપ અમારું પ્રેમથી  
કરીશું શ્રમ સખત અભ્યાસમાં અમે ખંતથી  
હો મેઘા તેજસ્વી અમારી એટલું પ્રભુ આપજો  
ને સંબંધ સદા સ્નેહભર્યો ગુરુ શિષ્યનો રાખજો

त्वमेव माता च पिता त्वमेव  
त्वमेव बंधू च सखा त्वमेव।  
त्वमेव विद्या द्रविणं त्वमेव  
त्वमेव सर्वं मम देव देव॥

[તમે છો માતા પિતા તમે છો  
તમે છો બંધુ સખા તમે છો  
તમે છો વિદ્યા વળી ધન સંપત્તિ  
પણ સર્વ મારું તમે હે દેવ દેવ]

मूकं करोति वाचालं पंगुं लघयते गिरिम्।  
यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम्॥

[જો તારી કૃપા ઉતરે તો મુંગો માણસ વાચાળ બને છે, અપંગ માણસ પહાડ ઓળંગી જાય છે. હે પરમાનંદ માધવ તને વંદન કરું છું.]

યા કુન્દેન્દુ તુષારહારધવલા યા શુભવસ્ત્રાવૃતા  
યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના।  
યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૃતિભિર્દેવૈઃ સદા વન્દિતા  
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા॥

[સૌંદર્યમંડિત છે જે શુભ શશિ સમ  
માળા છે જેની સુંદર જાળબિન્દુ સમ

ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા  
વીણાદંડ સોહે જેના કર કમળમાં  
વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું  
સદા વંદન કરે જેને સર્વ દેવો  
બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે

એવી દેવી મા સરસ્વતી દૂર કરજો  
અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને]

વક્રતુણ્ડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ।  
નિર્વિઘ્નં કરુ મે દેવ શુભકાર્યેષુ સર્વદા॥

[હે વાંકી સૂંઢવાળા, વિશાળ કાયા ધરાવતા, અસંખ્ય સૂરજ સમાન કાંતિ ધરાવતા ગણેશ દેવ મારા  
શુભ કાર્યમાં આવતી અડચણને હંમેશા દૂર કરતા રહેજો.]

શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશમ્।  
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્॥  
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્।  
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્॥

[ભગવાન વિષ્ણુની આ સ્તુતિનો ભાવાર્થ છે: શાંતિ પમાડતા, નાગની શૈયા ધરાવતા, નાભિમાંથી કમળ પ્રગટાવતા, દેવોના અધિપતિ, વિશ્વના આધારરૂપ, ગગન જેવા વિશાળ, મેઘવર્ણી કાયા અને શુભ અંગો ધારણ કરતા, લક્ષ્મીજીના પ્રિયતમ, કમળસમ નેત્રો ધરાવતા, યોગીઓ ધ્યાન ધરે છતાં તેમના માટે અગમ્ય રહેતા, ભવનો ભય હરનારા, સર્વ લોકના નાથ વિષ્ણુને વંદન હો]

સર્વે ભવન્તુ સુખિનઃ।  
સર્વે સન્તુ નિરામયાઃ।  
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।  
મા કશ્ચિત્ દુઃખ ભાગ્ભવેત્॥

[સર્વે બની રહે સુખી  
સર્વે બની રહે સ્વસ્થ  
મળે શુભદ્રષ્ટિ સર્વને  
ન દુઃખ ભોગવે કોઈ]

વન્દે માતરમ્। વન્દે માતરમ્।  
વન્દે માતરમ્। વન્દે માતરમ્॥

સુજલામ્ સુફલામ્ મલયજશીતલામ્।  
શસ્યશ્યામલામ્ માતરમ્।

વન્દે માતરમ્॥

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્।  
ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમ્।

સુહાસિનીમ્। સુમધુરભાષિણીમ્।  
સુખદાં વરદામ્ માતરમ્ ।

વન્દે માતરમ્॥

[વંદુ તુજને મા હો વંદુ તુજને મા  
વંદુ તુજને મા હો વંદુ તુજને મા

છો સભર તું જળથી ફળથી  
દખણાદી શીત વાયુ લહરથી  
પાકેલા લહેરાતા ધાન્ય થકી  
સુરત તુજ બની સુંદર શામળી

વંદુ તુજને મા હો વંદુ તુજને મા  
વંદુ તુજને મા હો વંદુ તુજને મા

શુભ ચન્દ્ર કિરણથી ઓપતી  
ખુશહાલ છે સૌ રાત્રિ તારી  
પુષ્પ ને વૃક્ષોથી લચી રહેલી  
શોભે છે કણ કણ ભૂમિ તારી

મલકાતું મોં વદતું મીઠી વાણી  
ને વરસાવે સદા સુખ વરદાન  
વંદુ તુજને મા હો વંદુ તુજને મા  
વંદુ તુજને મા હો વંદુ તુજને મા]

## જ્ઞાન ખજાનો

અ

અલસસ્ય કુતો વિદ્યા અવિચસ્ય કુતો ધનમ્।  
અધનસ્ય કુતો મિત્રં અમિત્રસ્ય કુતઃ સુખમ્॥

[આજસુ માણસને વિદ્યા ક્યાંથી મળે? વિદ્યા વિનાના માણસને ધન ક્યાંથી મળે? નિર્ધન માણસને મિત્ર ક્યાંથી મળે અને મિત્ર વિનાના માણસને સુખ ક્યાંથી મળે?]

अग्निः शेषं ऋणः शेषं शत्रुः शेषं तथैव च।  
पुनः पुनः प्रवर्धत तस्मात् शेषं न कारयेत्॥

[अग्नि, દેવું અને શત્રુ એ ત્રણનો જરાક અંશ બચી જાય તો તે ફરી ફરી વધ્યા જ કરે માટે તેના અંશને પણ બાકી રહેવા ન દેવાય.]

अग्निहोत्रं गृहं क्षेत्रं गर्भिणीं वृद्धबालकौ।  
रिक्तहस्तेन नोपेयाद् राजानं देवतां गुरुम्॥

[પવિત્ર અગ્નિ, પોતાનું ઘર, ખેતર, ગર્ભવતી સ્ત્રી, વૃદ્ધો, બાળકો, રાજા, દેવતા અને ગુરુ પાસે કદી ખાલી હાથે ન જવું જોઈએ.]

अजरामरवत् प्राज्ञो विद्यामर्थं च साधयेत्।  
गृहीत इव केशेषु मृत्युना धर्मम् आचरेत्॥

[ડાહ્યા માણસોએ જ્યારે જ્ઞાન કે ધન મેળવવાની વાત આવે ત્યારે પોતે અજરઅમર રહેવાના છે એવું વિચારીને વણથંભી સાધના કરવી જોઈએ અને જ્યારે ધર્મનું આચરણ કરવાની વાત આવે ત્યારે મોત ખંભા પર બેસી વાળ ખેંચી રહ્યું છે એમ માનીને તરત ધર્મનું આચરણ કરવું જોઈએ.]

अज्ञश्चाश्रद्धधानश्च संशयात्मा विनश्यति।  
नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः॥

[ભગવદ્ ગીતામાં ભગવાનનો આ ઉપદેશ છે: જે અજ્ઞાની છે અશ્રદ્ધાળુ છે અને દરેક વાતમાં શંકા કરે છે તેમનો નાશ થાય છે. શંકાશીલ માણસો માટે આ લોકમાં કે પરલોકમાં કોઈ સુખ નથી.]

अतितृष्णा न कर्तव्या तृष्णां नैव परित्यजेत्।  
शनैः शनैश्च भोक्तव्यं वित्तम् स्वयमुपार्जितम्॥

[ન અતિ તૃષ્ણા કરવી કે ન તૃષ્ણાનો સમૂળગો ત્યાગ કરવો. જાતે કમાયેલી સંપત્તિનો ધીમે ધીમે ઉપભોગ કરવો.]



अतिथि देवो भव।

[अतिथिने ईश्वरतुल्य गणी आदर आपवो.]

अतिदानाद्धतः कर्णस्त्वतिलोभात् सुयोधनः।

अतिकामाद्दशग्रीवस्त्व अति सर्वत्र वर्जयेत्॥

[अति दानथी कर्ण पासे कंઈ न रह्युं. अति लोभथी सुयोधननी अवदशा थई. अति छच्छाथी पतन थाय छे माटे क्कोई पण बाबतमां अतिशयताने तजवी. ]

अतिपरिचयादवज्ञा सततगमनात् अनादरो भवति।

मलये भिल्ला पुरांधी चंदनतरुकाष्ठम् इंधनम् कुरुते॥

[अति परिचयथी अवज्ञा थाय. क्कोईने त्यां सतत जईये तो आवकार न मणे. मलय पर्वत पर रहेती भीलडीओ चंदनने पण ईंधणनुं लाकडुं गणी यूलामां बाणे छे.]

अतिस्नेहः पापशङ्की।

[क्कोईने माटे आपणो वधु पडतो प्रेम आपणां मनमां आपणा ते प्रिय पात्रनी सलामती माटे ખોटी शंका पेदा करे छे. અભિજ્ઞાન શાકુંતલમનું આ વાક્ય છે.]

अद्यापि दुर्निवारं स्तुतिकन्या वहति नाम कौमारम्।

सद्भ्यो न रोचते सा असन्तः अपि अस्यै न रोचन्ते॥

[स्तुति नामनी कन्या बियारी हजु कुंवारी छे केम के सारा माणसोने अे गमती नथी तो जे सारा नथी ते अेने गमता नथी !]

अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा।

अनुग्रहश्च दानं च एष धर्मः सनातनः॥

[મન, વચન અને કર્મથી કોઈ જીવનો દ્રોહ ન કરવો, પ્રેમ રાખવો અને ઉદારતાથી દાન આપવું એ સનાતન ધર્મ છે.]

અધમા: ધનમિચ્છન્તિ ધનં માનં ચ મધ્યમા:।

ઉત્તમા: માનમિચ્છન્તિ માનો હિ મહતામ્ ધનમ્॥

[નિમ્ન કક્ષાના માણસો ફક્ત ધનની ઇચ્છા રાખે છે. મધ્યમ કક્ષાના માણસો ધન અને માન બન્નેની ઇચ્છા રાખે છે. પણ ઉત્તમ માણસોની ઇચ્છા ફક્ત માન મેળવવાની હોય છે કેમકે માન સૌથી ચડિયાતું ધન છે.]

અનભ્યાસે વિષં વિદ્યા અજીર્ણે ભોજનં વિષં।

વિષં સભા દરિદ્રસ્ય વૃદ્ધસ્ય તરુણી વિષં॥

[અભ્યાસ ન કર્યો વિદ્યા વિષ સમાન બને છે, જ્યારે પાચન ન થતું હોય ત્યારે ભોજન ઝેર બને છે. સંપત્તિ વિહોણા માટે સભા એટલે કે જાહેરમાં જવું ઝેર જેવું બને છે તો વૃદ્ધો માટે યુવાન સ્ત્રી વિષની ગરજ સારે છે !]

અન્તસ્તિમિરનાશાય શબ્દબોધો નિરર્થક:।

ન નશ્યતિ તમો નામ કૃતયા દીપવાર્તયા॥

[મનના તિમિરને મીટાવવા શબ્દોનો બોધ કંઈ કામમાં આવતો નથી. જેમ દીવો, દીવો એવો શબ્દજાપ કરતાં રહીએ તો અંધારું થોડું દૂર થાય છે ?]

અન્નદાનં પરં દાનં વિદ્યા દાનમ્ અત: પરમ્।

અન્નેન ક્ષણિકા તૃપ્તિ: યાવજ્જીવન્ચ વિદ્યાયા॥

[અન્નદાન ઘણી મોટી વાત છે પણ વિદ્યાદાન તેનાથી પણ મોટી વાત છે. અન્નથી થોડો વખત તૃપ્તિ અનુભવાય છે પણ વિદ્યા વડે આજીવન તૃપ્તિ મળે છે.]

અન્યક્ષેત્રે કૃતં પાપં પુણ્યક્ષેત્રે વિનશ્યતિ।

પુણ્યક્ષેત્રે કૃતં પાપં વજ્રલેપો ભવિષ્યતિ॥

[અન્ય ક્ષેત્રે કરેલું પાપ તીર્થમાં જઈ ઘોઈ શકાય છે. પણ તીર્થક્ષેત્રમાં જો પાપ કરીએ તો તે વજ્રલેપ બની જાય છે.]

અપમાનિતોઽપિ કુલજો ન વદતિ પુરુષં સ્વભાવદાક્ષિણ્યાત્।  
નહિ મલયચન્દનતરુઃ પરશુપ્રહતઃ સ્રવેત્ પૂયમ્॥

[કુહાડીથી પ્રહાર થવા છતાં મલય પર્વત પર ઊગતા ચંદનના વૃક્ષમાંથી જેમ નકામો પદાર્થ બહાર આવતો નથી તેમ અપમાન થવા છતાં કુળવાન માણસો પોતાનું સૌજન્ય છોડી જેમ તેમ બોલતા નથી.]

અપિ ક્રિયાર્થં સુલભં સમિત્કુશમ્  
જલાન્યપિ સ્નાનવિધિક્ષમાણિ તે ।  
અપિ સ્વશક્ત્યા તપસિ પ્રવર્તસે  
શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ॥

[કાલિદાસ કૃત કુમારસંભવમ્ સર્ગ-૫-૩૩. યજ્ઞ કરવા માટે સમીધના ટૂકડાં અને કુશ ઘાસ સહેલાઈથી મળે છે ? સ્નાન માટે પાણી યોગ્ય છે ? તમે તમારી શક્તિ અનુસાર તપ કરો છો ? શરીર ધર્મ કરવા માટેનું સાધન છે.]

અપિ સ્વર્ણમયી લઙ્કા ન મે લક્ષ્મણ રોચતે।  
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી॥

[હે લક્ષ્મણ, આ લંકા સોનાની છે તો પણ તે મને ગમતી નથી. જનની અને જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે. વાલ્મિકી રામાયણમાં લંકા વિજય પછી લંકાનું રાજ સ્વીકારવાની ના પાડતા રામ આ વાક્ય કહે છે.]

અર્પવઃ કોપિ કોશોયં વિદ્યતે તવ ભારતિ।  
વ્યયતો વૃદ્ધિમ્ આયાતિ ક્ષયમ્ આયાતિ સંચયાત્॥

[હે દેવી સરસ્વતી, તારો ખજાનો ખરેખર અનોખો છે. જો તે વાપરીએ તો વધતો રહે છે અને જો તે સાચવીને રાખી મૂકીએ તો તેમાં ઘટાડો થાય છે. જ્ઞાનનું એવું છે કે તે જેમ ઉપયોગમાં લેવાય તેમ વધે અને ઉપયોગ કર્યા વિના પડ્યું રહે તો કટાઈ જાય.]

अयं निजः परो वेऽति गणना लघुचेतसाम्।

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम्॥

[આ મારું છે, તે બીજાનું છે એવી ગણતરી તો જેનું મન સાંકડું હોય તેવા લોકોની હોય. જેનું મન ઉદાર હોય તેને તો આખું ય જગત પોતાના કુટુંબ જેવું લાગે.]

अरसिकेषु कवित्वनिवेदनं शिरसि मा लिख मा लिख मा लिख ।

[હે વિદ્યાતા, અરસિક માણસો પાસે કવિતા પ્રસ્તુત કરવાનું મારા કપાળે ન લખ, ન લખ, ન લખ. કાલિદાસે કોઈક વખત કંટાળીને આવી પ્રભુપ્રાર્થના કરી હોવાનું મનાય છે.]

अर्थातुराणां न गुरुर्न बन्धुः कामातुराणां न भयं न लज्जा।

विद्यातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न रुचिर्न वेला॥

[જેમને પૈસા કમાવાની આતુરતા હોય તેને ન તો ગુરુ દેખાય, ન ભાઈ દેખાય. જેને કામેચ્છા જાગે તેને ન કોઈનો ડર લાગે, ન કોઈની શરમ નડે. જેને વિદ્યા પ્રાપ્તિની તડપ જાગે તેના જીવને ન શાંતિ હોય, ન ઊંઘ આવે. જેને ભૂખ લાગે તે ન રૂચિ જૂએ કે ન શું સમય થયો છે તે જૂએ.]

अल्पकार्यकराः सन्ति ये नरा बहुभाषिणः।

शरत्कालिनमेघास्ते नूनं गर्जन्ति केवलं॥

[ઓછું કામ કરવાવાળા બહુ બોલ બોલ કરતા થઈ જાય. શરદ ઋતુમાં મેઘરાજા વરસે ઓછું ને ગરજે વધુ.]

अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तसन्तिनः॥

[નાની નાની બાબતનું ધ્યાન રાખી તેને સુવ્યવસ્થિત બનાવીને કામમાં સફળતા મેળવી શકાય છે. નાના નાના દોરાને ગૂંથી તેનું એવું મજબૂત દોરડું બનાવી શકાય કે જે મદમસ્ત હાથીને પણ બંધનમાં જકડી શકે.]

અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે।  
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પષ્ટિતાઃ॥

[ભગવત ગીતાનો આ શ્લોક છે. ભગવાન અર્જુનને કહે છે કે જેની ચિંતા કરવા જેવું નથી તેની તું ચિંતા કરે છે, બુદ્ધિશાળી માણસો જેવું બોલે છે પણ જે જ્ઞાની હોય તે કદી ભૂતકાળની કે ભવિષ્યકાળની ચિંતા કરી વ્યાકુળ થતા નથી.]

અસારે ખલુ સંસારે સારં શ્વશુરમન્દિરમ્।  
હરો હિમાલયે શેતે હરિઃ શેતે મહોદધૌ॥

[આ અસાર સંસારમાં સાચો સાર શ્વસુરના ઘરમાં છે ! એટલે તો ભગવાન શંકર હિમાલયમાં જઈને રહે છે અને વિષ્ણુ ભગવાન સમુદ્રમાં જઈને રહે છે !]

અશ્વં નૈવ ગજં નૈવ વ્યાઘ્રં નૈવ ચ નૈવ ચ।  
અજાપુત્રં બલિં દદ્યાત્ દેવો દુર્બલઘાતકઃ॥

[બલિદાન કોનું દેવાય ? ઘોડાનું ? કદી નહિ. હાથીનું ? કદી નહિ. વાઘનું ? ના ભાઈ ક્યારેય નહિ. બલિદાન તો બકરીના બચ્ચાંનું જ દેવાય ! દેવ પણ નબળાંનો ભોગ લે છે !]

અશ્વત્થામા બલિ વ્યાસો હનુમાંશ્ચ બિભીષણઃ।  
કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ॥

[આપણી પૌરાણિક માન્યતા પ્રમાણે અશ્વસ્થામા, બલી રાજા, વ્યાસ મુનિ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ એ સાતને અમરત્વનું વરદાન મળેલું છે.]

अश्वस्य भूषणं वेगो मत्तं स्याद् गजभूषणम्।  
चातुर्यम् भूषणं नार्या उद्योगो नरभूषणम्॥

[घोडानुं ભૂષણ વેગ છે, હાથીનું ભૂષણ મદ છે. ચતુરાઈ એ નારીનું ભૂષણ છે તો જહેમત એ નરનું ભૂષણ છે.]

अष्टादशपुराणेषु व्यासस्य वचनद्वयम्।  
परोपकारः पुण्याय पापाय परपीडनम्॥

[અઠાર પુરાણનો સાર વ્યાસ મુનિના બે વચનોમાં સમાઈ જાય છે: પરોપકાર કરવો એ પુણ્ય છે અને પરપીડન કરવું એ પાપ છે.]

अहन्यहनि भूतानि गच्छन्ति यमालयम्।  
शेषाः स्थावरमिच्छन्ति किमाश्चर्यमतः परम्॥

[મહાભારતના વનપર્વમાં આવતા યક્ષ યુધિષ્ઠિર સંવાદનો આ શ્લોક છે: અન્ય માણસો એક પછી એક મૃત્યુ પામે છે તેવું જોવા છતાં બાકીના માણસો પોતે જાણે કાચમ જીવતા રહેવાના છે એવી અપેક્ષા સાથે શાંતિથી જીવે છે તેનાથી વધુ મોટું આશ્ચર્ય જગતમાં શું હોઈ શકે ?]

अहं ब्रह्मास्मि।

[અનહલક. હું ઈશ્વર છું.]

अहिंसा परमो धर्मः।

[અહિંસા સૌથી મોટો ધર્મ છે.]

अहो दुर्जनसंसर्गात् मानहानिः पदे पदे।  
पावको लोहसङ्गेन मुद्गरैरभिताड्यते॥

[ખોટા માણસોની સાથે રહેવાથી ડગલે ને પગલે માર ખાવો પડે છે. સોનું પણ આગ અને લોખંડ જેવા પદાર્થોના સંપર્કમાં આવે ત્યારે તેની ઉપર હથોડીથી ઘડાઘડ પ્રહારો પડવા શરૂ થઈ જાય છે]

## આ

આ નો ભદ્રા ક્રતવો યન્તુ વિશ્વતઃ।

[ઋગ્વેદનો મંત્ર: બધી દિશાઓમાંથી કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ.]

આકારૈઘૈવ ચતુરાઃ તર્કયન્તિ પરેઙ્ગિતમ્।  
ગર્ભસ્થં કેતકીપુષ્પમામોદેનેવ ષટ્પદાઃ॥

[હોંશિયાર માણસોને બાહ્ય આકાર જોઈને અંદર શું હશે તે તેની ખબર પડી જાય છે. ભમરો સુગંધ પરથી જ કેતકી પુષ્પની કળીને પારખી લે છે. ]

આકાશાત્ પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ્।  
સર્વદેવનમસ્કારઃ કૈશવં પ્રતિ ગચ્છતિ॥

[આકાશમાંથી કોઈ પણ નદીમાં પડતું પાણી વહીને જેમ સાગરમાં મળી જાય છે તેમ કોઈ પણ દેવીદેવતાને કરેલું વંદન એક માત્ર ઈશ્વરને પહોંચે છે.]

આતુરે વ્યસને પ્રાપ્તે દુર્ભિક્ષે શત્રુસંકટે।  
રાજદ્વારે શ્મશાને ચ યસ્તિષ્ઠતિ સ બાન્ધવઃ॥

[સંકટના સમયે, દુષ્કાળમાં, શત્રુની ઉપાધિમાં, રાજ દરબારમાં અને સ્મશાનમાં આપણી બાજુમાં ઊભો રહે તે જ સાચો સગો છે.]

આત્મનઃ પ્રતિકૂલાનિ પરેષામ્ ન સમાચરેત્॥

[ભગવદ્ ગીતાનું કથન છે: જે આપણા માટે પ્રતિકૂળ હોય એટલે કે જે આપણને અનુકૂળ ન હોય તેવું આચરણ બીજા સાથે કરવું ન જોઈએ ]

આત્મનઃ મુખદોષેણ બધ્યન્તે શુકસારિકાઃ।  
બકાસ્ત્ર ન બધ્યન્તે મૌનં સર્વાર્થસાધનમ્॥

[મૌનથી બધા હેતુ સરે છે. બોલ બોલ કરવાના પોતાના વાંકે પોપટ તથા મેનાને પાજરામાં પૂરાવું પડે છે જ્યારે મૌન રહેતા બગલાને કોઈ બંધન સહન કરવું પડતું નથી.]

આત્મનો ગુરુઃ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ યત્ |  
પ્રત્યક્ષાનુમાનાભ્યામ શ્રેયસવનુબિન્દતે ॥

[આપણે જ આપણા ગુરુ છીએ કેમકે આપણે જ આપણને શીખવતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અનુભવ અને અનુમાનથી વધુ સારુ શું છે તેનો આપણને ખ્યાલ આવી જાય છે.]

આત્મપક્ષં પરિત્યજ્ય પરપક્ષેષુ યો રતઃ |  
સ પરૈર્હન્યતે મૂઢઃ નીલવર્ણશૃગાલવત્ ॥

[પંચતંત્રની એક વાર્તાનો સારાંશ છેઃ જે માણસ પોતાનો પક્ષ છોડી બીજાના પક્ષમાં રચ્યોપચ્યો રહે તે મૂર્ખ નીલરંગી શિયાળની માફક માર્યો જાય છે.]

આત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સઃ પઙ્કિતઃ |

[ભગવદ્ ગીતામાં ભગવાનનું કથનઃ જેવો હું છું તેવા જ આ જગતના સર્વે જીવ છે એવું જેને ભાન થાય તે પંડિત કહેવાય.]

આદૌ રામતપોવનાદિગમનં હત્વા મૃગકાન્ચનમ્ |  
વૈદેહીહરણં જટાયુમરણં સુગ્રીવસંભાષણમ્ ॥  
વાલીનિર્દલનમ્ સમુદ્રતરણં લઙ્કાપુરીદાહનમ્ |  
પશ્ચાદરાવણકુમ્ભકર્ણહનનં એતદ્ ઇતિ રામાયણમ્ ॥

[લાંબા લયક રામાયણને ટૂંકમાં પતાવવું છે ? તો સાંભળો. પહેલા રામ તપોવનમાં ગયા, સોનાના હરણ પાછળ દોડ્યા, સીતાનું હરણ થયું, જટાયુનું મરણ થયું, સુગ્રીવ સાથે વાતો થઈ, વાલી માર્યો ગયો, સમુદ્રનું તરણ થયું, લંકાનું દહન થયું, રાવણ, કુંભકર્ણનું હનન થયું. બસ રામાયણ પૂરું થયું.]



आर्ता देवान् नमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः।  
निर्धनाः दानम् इच्छन्ति वृद्धा नारी पतिव्रता॥

[દુઃખી માણસ દેવને પગે લાગે છે. રોગી માણસ તપ કરે છે. નિર્ધન માણસ દાનને ઝંખે છે. વૃદ્ધ નારી પતિવ્રતા બને છે !]

આલસ્યં हि मनुष्याणां शरीरस्थो महारिपुः।  
नास्त्युद्यमसमो बन्धुः कुर्वाणो नावसीदति॥

[આલસ એ માણસના શરીરમાં રહેલો તેનો મોટો શત્રુ છે. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી. ઉદ્યમ કરનારો કદી નાશ પામતો નથી.]

आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला।  
यया बद्धाः प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥

[આશા નામનું મનુષ્યનું બંધન ભારે અદ્ભુત બંધન છે. આ બંધનથી બંધાયેલો માણસ દોડવા લાગે છે તો આ બંધનથી મુક્ત થયેલ માણસ અપંગની જેમ સ્થિર થઈ જાય છે !]

आस्ते भग आसीनस्य ऊर्ध्वस्तिष्ठति तिष्ठतः।  
शेते निपद्यमानस्य चराति चरतो भगः॥

[મહાભારતનો શ્લોક છે: જે માણસ કામ કર્યા વિના બેઠો રહે તેનું નસીબ બેઠેલું રહે છે. જે ઊભો ઊભો વિચાર કર્યા કરે છે તેનું નસીબ પણ ઊભું જ રહી જાય છે. જે માણસ ઊંઘી જાય તેનું નસીબ ઊંઘી જાય છે પણ જે ચાલતો જ રહે તેનું નસીબ ચાલવા લાગે છે.]

आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम्।  
धर्मो हि तेषाम् अधिकोविशेषो धर्मण हीनाः पशुभिः समानाः॥

[આહાર, નિદ્રા, ભય અને મૈથુનની બાબતમાં પશુ અને માણસમાં કોઈ ફરક નથી. માણસમાં ધર્મ એક એવી ચીજ છે જે પશુમાં હોતી નથી. આથી ધર્મ વિનાનો માણસ પશુ જેવો જ લેખાય.]

૬-૬

इतो भ्रष्टस्ततो नष्टः।

[અહીં જઈશ તો ભ્રષ્ટ થઈશ. ત્યાં જઈશ તો નષ્ટ થઈશ.]

इदमद्य करिष्यामि श्वः कर्तास्मि इति वादिनम्।

कालो हरति संप्राप्तो नदीवेग इव द्रुमम् ॥

[જેમ નદીમાં આવેલું પૂર પોતાના વેગમાં વૃક્ષને તાણી જાય છે તેમ આ કામ આજે કરીશ આ કામ કાલે કરીશ એવી વાતો કરનારાને સમયનું પૂર પોતાની સાથે ખેંચી જાય છે.]

ईशावास्यमिदं सर्वं यत् किञ्च जगत्यां जगत्।

तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद् धनम्॥

[ઈશાવાસ્ય ઉપનિષદનો તત્વજ્ઞાનીઓને ખૂબ જ પ્રિય એવો શ્લોક. જડ અને ચેતનતત્વના બનેલા આ જગતના અણુંએ અણુંમાં ઈશ્વર છે અને તે જ તેનો સ્વામી છે. આ જગતને માણ પણ ત્યાગના ભાવ સાથે માણ. એવું માનતો નહિ કે તારા એકલાની કોઈ ચીજ છે. જે કંઈ છે તેના પર અન્યનો પણ એટલો જ અધિકાર છે. અન્યના અધિકારને કદી છીનવી લેતો નહિ.]

૩-૩

उत्तमो नातिवक्ता स्यात् अधमो बहु भाषते।

न काञ्चने ध्वनिस्तादृक् यादृक् कांस्ये प्रजायते॥

[નકામો માણસ બહુ બોલ બોલ કરે એટલે ઉત્તમ વક્તા બની જતો નથી. સોનાનો જેટલો અવાજ આવે તેના કરતાં કાસાનો અવાજ અનેકગણો આવે છે.]

उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।

क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्ग पथस्तत्कवयो वदन्ति॥

[કહોપનિષદ અધ્યાય-૧ વલ્લી-૩નો શ્લોકઃ ઊઠો જાગો તમારાથી ચડિયાતા જાણકારો પાસેથી જ્ઞાન મેળવો. કવિઓ (એટલે કે વિદ્વાનો) કહે છે કે જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ છરીની ધાર પર ચાલવા જેવો આકરો છે.]

उत्पद्यन्ते विलीयन्ते दरिद्राणां मनोरथाः।

[ગરીબ માણસને મનમાં ઇચ્છાઓ જાગતી રહે ને ભૂલાતી રહે. તેનું પરિણામ કંઈ ન આવે.]

उत्सवप्रियाः खलु मनुष्याः।

[કાલિદાસનું કથનઃ બધા માણસોને તહેવાર માણવા ગમે છે.]

उत्साहो बलवानार्य नास्त्युत्साहात्परं बलम्।

सोत्साहस्य च लोकेषु न किञ्चिदपि दुर्लभम्॥

[ઉત્સાહમાં ખૂબ બળ હોય છે. ઉત્સાહથી વધુ મોટું બળ કોઈ નથી. એટલે ઉત્સાહી માણસો માટે કોઈ કામ અઘરું નથી.]

उदये सविता रक्तो रक्तश्चास्तमने तथा।

सम्पत्तौ च विपत्तौ च साधूनामेकरूपता॥

[ઊગતો સૂરજ લાલ રંગનો હોય છે, આથમતો સૂરજ પણ લાલ રંગનો જ હોય છે. સજ્જન માણસના રંગ ઢંગ સુખમાં કે દુઃખમાં સરખા જ રહે છે.]

उदारस्य तृणं वित्तं शूरस्य मरणं तृणं।

विरक्तस्य तृणं भार्या निस्पृहस्य तृणं जगत्॥

[ઉદાર માણસને ધનનું મહત્વ તણખલા જેટલું હોય છે, શૂરવીર માણસને મોત તણખલા જેટલું તુચ્છ લાગે છે, સંસારમાં રસ ન હોય તેવા માણસને પત્નીની કોઈ કીમત હોતી નથી તો જે નિસ્પૃહી માણસ છે તેને આખું જગત તણખલા જેવું નકામું લાગે છે.]

**ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્।**  
**આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ॥**

[ભગવદ્ ગીતાનો ઉપદેશઃ આત્માનો ઉદ્ધાર આત્મા વડે જ કરવો જોઈએ. આત્માની કદી અવનતિ થવા ન દેવી જોઈએ. આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે.]

**ઉદ્યમસ્સાહસં ધૈર્યં બુદ્ધિશક્તિઃ પરાક્રમઃ।**  
**ષડ્ એતે યત્ર વર્તન્તે દેવઃ તત્ર સહાયકૃત્॥**

[જ્યાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ એ છ બાબત હોય ત્યાં પ્રભુની બધી મદદ મળી રહે છે.]

**ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથૈઃ।**  
**ન હિ સુમ્પસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાઃ॥**

[માત્ર મનના ઘોડા દોડાવ્યે નહિ મહેનત કરવાથી જ કામ થાય. સિંહ જો સૂતો રહે તો એના મોંમા શિકાર થવા હરણો સામેથી ન આવે.]

**ઉદ્યોગિનં પુરુષ સિંહમુપૈતિ લક્ષ્મીઃ।**

[મહેનત કરતા હોય તેવા પરાક્રમી પુરુષ પાસે જ લક્ષ્મી આવે છે.]

**ઉપકારગૃહીતેન શત્રુણા શત્રુમુદ્ધરેત્।**  
**પાદલગ્નં કરસ્થેન કણ્ટકેનૈવ કણ્ટકમ્॥**

[શત્રુની મદદ લઈને શત્રુનો નાશ કરવો જોઈએ. પગમાં કાંટો લાગે તો બીજા કાંટાનો ઉપયોગ કરી કાઢી નખાય.]

उपकारोऽपि नीचानां अपकारो हि जायते।  
पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम्॥

[अधम माणस पर ઉપકાર કરો તો તેના બદલે અપકાર જ મળે. સાપને દૂધ પીવડાવો તો તેનું ઝેર ઓર વધે.]

उपमा कालिदासस्य भारवेरर्थगौरवम्।  
दण्डिनः पदलालित्यं माघे सन्ति त्रयो गुणाः॥

[ઉપમા કાલિદાસની વખણાય. શબ્દને અર્થગૌરવ અર્પવામાં ભારવિ બેજોડ છે. પદલાલિત્ય તો દણ્ડિ જેવું કોઈનું ન થાય પણ માઘની કૃતિઓમાં આ ત્રણે વિશિષ્ટતા જોવા મળે છે.]

उष्ट्राणां विवाहेषु गीतं गायन्ति गर्दभाः।  
परस्परं प्रशंसन्ति अहो रूपं अहो ध्वनिः॥

[ઊંટના લગ્નમાં ગધેડા ગીત ગાય છે અને બન્ને એક બીજાના વખણ કરે કે વાહ શું તારું રૂપ છે ને વાહ શું તારો કંઠ છે !]

એ-એ-ઓ-ઓ-અં-અં:

एक एव खगो मानी चिरंजीवतु चातकम्।  
म्रियते वा पिपासार्ते याचते वा पुरंदरम्॥

[હે ચાતક, તું અમર રહે. તું બધા પક્ષીમાં શ્રેષ્ઠ છે કારણ કે તું એક જ એવું પક્ષી છે જે તરસ લાગે ત્યારે માત્ર ઈન્દ્રદેવતા પાસે યાચના કરે છે અથવા મોત વહાલું કરે છે. (ચાતક માત્ર આકાશમાંથી પડતું પાણી પીએ છે. એ સિવાય અન્ય પાણી નહિ એવી દંતકથા છે.)]

एकं सद् विप्राः बहुदा वदन्ति।  
अग्निं यमं मातरिश्वानम् आहुः॥

[‘અલ્લાહો અકબર’નો પૈગામ આ જગતને મળ્યો તેના સેંકડો વર્ષ અગાઉ ઉપનિષદમાં એ જ વાત ઘણી વખત કહેવાઈ ગઈ છે. એક જ સત્ય એટલે કે એક જ ઈશ્વર છે. ફક્ત વિદ્વાનો તેને જુદા જુદા નામ આપે છે. અગ્નિ, યમ, માતરિશ્વા, વાયુ એ બધું અતે તો એકનું એક જ છે.]

एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना।  
वासितं तद्वनं सर्वम् सुपुत्रेण कुलं यथा॥

[એક સુંદર પુષ્પ આખા ઝાડને સુગંધથી મધમધતું કરી દે છે. એવી જ રીતે એક સુપુત્રથી આખા કુટુંબનું નામ રોશન થઈ જાય છે.]

एकोऽहं बहु स्याम् प्रजायेय।

[હું એક છું પણ અનેક રૂપ ધારણ કરું છું.]

अंगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम्।  
वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डम्॥

[જગતગુરુ શંકરાચાર્યનો ઉપદેશ: વૃદ્ધાવસ્થાથી શરીર જર્જરિત થઈ ગયું છે, માથાના વાળ સફેદ થઈ ગયા છે, દાંત પડી ગયા છે, લાકડીના ટેકે ચાલવું પડે છે છતાં આશાઓના બંધન હજી છૂટતા નથી.]

५

कन्या वरयते रूपं माता वित्तं पिता श्रुतम्।  
बान्धवाः कुलमिच्छन्ति मिष्टान्नम् इतरेजनाः॥

[લગ્નની પસંદગીમાં કન્યા રૂપને, માતા સંપત્તિને, પિતા શિક્ષણને અને ભાઈઓ કુળને મહત્વ આપે છે. બાકીના બધાને તો મિષ્ટાન્નમાં શું ખાવા મળશે એ વાતમાં જ રસ હોય છે.]

कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती।  
करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्॥

[કરના ઉપરના ભાગમાં લક્ષ્મી વસે છે, કરના વચ્ચેના ભાગમાં સરસ્વતી રહે છે તો કરના નીચેના ભાગમાં કૃષ્ણનો વાસ છે માટે સવારે ઊઠીને સૌથી પહેલા કરના દર્શન કરવા જોઈએ.

લક્ષ્મીની ગણતરી આંગળી વડે કરાય એટલે લક્ષ્મી કરાગ્રે રહે છે, કલમ બે આંગળી અને અંગુઠા વચ્ચે પકડવી પડે એટલે સરસ્વતીનો નિવાસ કરમધ્યે લેખાય અને કરની બધી હિલચાલનો આધાર કાંડા પર રહે છે એટલે જગતનો નાથ કરમૂલમાં રહે છે એવું અર્થઘટન પણ કરવામાં આવે છે. અપના હાથ જગન્નાથ અર્થાત્ ‘આપણો હાથ જ આપણો ભગવાન છે’ એ કહેવત જેવો જ ધ્વનિ આ શ્લોકમાંથી ઉપસે છે.]

**कर्ता कारयिता चैव प्रेरकश्च अनुमोदकः।**

**सुकृते दुष्कृते चापि चत्वारः समभागिनः॥**

[કોઈ કામ ભલે સારું હોય કે ખરાબ પણ તે કામ કરનાર, તે કામ કરાવનાર, તે કામની પ્રેરણા આપનાર અને તે કામનું સમર્થન કરનાર એ ચારે જણ તે કામના સરખા ભાગીદાર ગણાય.]

**कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।**

**मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥**

[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશ: તારો અધિકાર ફક્ત કર્મ કરવા પૂરતો છે. ફળ પર કદાપિ નહિ. એટલે તારું મન તું કર્મના ફળ પર ક્યારેય કેન્દ્રિત કરીશ નહિ. અને કદી કર્મ ન કરવામાં પણ આસક્તિ રાખીશ નહિ.]

**कस्यैकान्तं सुखम् उपनतं दुःखम् एकान्ततो वा।**

**नीचैर् गच्छति उपरि च दशा चक्रनेमिक्रमेण॥**

[કાલિદાસના મેઘદૂત કાવ્યમાં આ તત્ત્વજ્ઞાન પીરસાયું છે: કોને જીવનમાં સતત સુખ મળે કે સતત દુઃખ મળે છે ? ચકાકારે ફરતી વસ્તુમાં જેમ ઉપરનો ભાગ નીચેના ભાગનું સ્થાન લે અને નીચેનો ભાગ ઉપરના ભાગનું સ્થાન લે તેમ સુખ અને દુઃખ એક બીજાના સ્થાને સતત આવતા જ રહે છે.]

काकः कृष्णः पिकः कृष्णः को भेदः पिककाकयोः।  
वसन्तसमये प्राप्ते काकः काकः पिकः पिकः॥

[કાગડો કાળો હોય છે, કોયલ પણ કાળી હોય છે. બન્ને વચ્ચે ફરક શું છે ? વસંત ઋતુ આવે કાગડાનું કાગડાપણું અને કોયલનું કોયલપણું આપમેળે પરબાઈ આવે છે.]

काकचेष्टा वकोध्यानं श्वाननिद्रा तथैव च।  
अल्पहारी गृहत्यागी विद्यार्थी पंचलक्षणम्॥

[સાચા વિદ્યાર્થીના આ પાંચ લક્ષણ છે: કાગડા જેવી ચક્રોર નજર, બગલા જેવું પાકું ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, ઓછો આહાર અને ઘરની માયાનો ત્યાગ.]

काकस्य कति दन्ता वा मेषस्याण्डे कियत्पलम्।  
गदर्भे कति रोमाणि व्यर्थेषा विचारणा॥

[કાગડાની ચાંચમાં દાંત કેટલા છે ? દેડકાએ ઈંડા કેટલા મૂક્યા છે ? ગધેડાના શરીર પર વાળ કેટલા છે ? એવી તદ્દન વ્યર્થ ગણતરીઓ કર્યા કરવાનો કોઈ મતલબ નથી.]

कान्तावियोगः स्वजनापमानं ऋणस्य शेषं कुनृपस्य सेवा।  
दारिद्र्यभावाद् विमुखं च मित्रं विनाग्निना पञ्च दहन्ति कायम्॥

[પ્રિય વ્યક્તિનો વિયોગ, સ્વજન પાસેથી મળેલું અપમાન, ચૂકવવું બાકી રહેતું દેવું, ખરાબ માલિકની નોકરી અને ગરીબાઈના કારણે મિત્ર ખોઈ બેસવો એ પાંચ વસ્તુ એવી છે કે જે તમને અગ્નિ વિના સતત બાળતી રહે.]

कान्पृच्छामः सुराः स्वर्गे निवसामो वयं भुवि।  
किं वा काव्यरसः स्वादुः किंवा स्वादीयसि सुधा॥

[પૂછવું કોને? દેવ બધા સ્વર્ગમાં છે અને અમે ધરતી પર. અમારે માત્ર એટલું જાણવું છે કે વધુ સ્વાદમય શું છે ? કાવ્યરસ કે અમૃત ?]



कार्याथीर् भजते लोकः यावत्कार्यम् न सिध्यति।  
उत्तीर्णं च परे पारे नौकाया किं प्रयोजनम्॥

[જ્યાં સુધી ધારેલું કામ નીકળી ન જાય ત્યાં સુધી માણસ બીજાને ભજે છે. એક વખત નદી પાર ઉતરી ગયા પછી હોડકું શું કામ આવે ?]

कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा।  
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा॥

[મહત્વના કામમાં મદદનીશ, ઘરના કામમાં નોકરાણી, ભોજન કરાવવામાં માતા, સહશયનમાં અપ્સરા, ધર્મની બાબતમાં સહધર્મિણી અને ધરતી જેટલી ક્ષમાશીલ આ છ ગુણ ધરાવતી પત્ની મળવી દુર્લભ છે.]

काले मृदुर् यो भवति काले भवति दारुणः।  
स वै सुखम् अवाप्नोति लोकेऽमुष्मिन् इहैव च॥

[જે માણસ સમય આવ્યે મૃદુ બની શકે અને સમય આવ્યે આકરો બની શકે તે જ આ લોકમાં સુખી થઈ શકે.]

कालो वा कारणं राज्ञः राजा वा कालकारणं।  
इति ते संशयो मा भूत् राजा कालस्य कारणम्॥

[સૂચિત અર્થઃ તમે જે કંઈ છો તે સંજોગોને કારણે છો કે તમારી આજુબાજુ જે સંજોગો છે તે તમારે કારણે છે એવી કોઈ શંકા મનમાં રાખશો નહિ. તમારા સંજોગો તમારા કારણે જ છે. તમે જ તેના સ્વામી છો. સમયના કારણે રાજા નથી રાજાના કારણે સમય છે.]

काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्।  
व्यसनेन तु मूर्खाणां निद्रया कलहेन वा॥

[બુદ્ધિમાન માણસનો સમય કાવ્ય, સાહિત્ય ને શાસ્ત્રની ચર્ચામાં પસાર થાય છે. જ્યારે મૂર્ખ માણસ વ્યસનના સેવનમાં, ઊંઘવામાં કે ઝગડા કરવામાં પોતાનો સમય વેડકે છે.]

કાવ્યેષુ નાટકં રમ્યં તત્ર રમ્યં શકુન્તલા।  
તત્રાપિ ચ ચતૂર્થોઽકો તત્ર શ્લોકચતુષ્ટયમ્॥

[બધા કાવ્યોમાં નાટક સૌથી સરસ ગણાય, બધા નાટકમાં અભિજ્ઞાન શાકુંતલમ્ નાટક વધુ સરસ છે. શાકુંતલમ્માં તેનો ચોથો અંક સૌથી સરસ છે અને ચોથા અંકમાં તેના ચાર શ્લોક સૌથી સરસ છે.]

કિં વાસસા ઇત્યત્ર વિચારણીયં વાસઃ પ્રધાનં ખલુ યોગ્યતાયૈ।  
પીતામ્બરં વીક્ષ્ય દદૌ સ્વકન્યાં દિગમ્બરં વીક્ષ્ય વિષં સમુદ્રઃ॥

[કપડાંથી શું થાય એ વિચારવા જેવી વાત છે. યોગ્યતા માપવાનું સૌથી મહત્વું સાધન કપડા છે. વિષ્ણુનું સુંદર પીતામ્બર જોઈ રત્નાકરે પોતાની પુત્રી તેને આપી જ્યારે દિગમ્બર શિવજીને જોઈને ઝેરનો કટોરો ધર્યો !]

કિમ્ અશક્યં બુદ્ધિમતાં કિમ્ અસાધ્યં નિશ્ચયં દૃઢં દધતામ્।  
કિમ્ અશક્યં પ્રિયવચસાં કિમ્ અલભ્યંમ્ ઇહોદ્યમસ્થાનામ્॥

[જેમની પાસે બુદ્ધિ છે તેમના માટે કશું અશક્ય નથી. જેમનો નિશ્ચય દ્રઢ છે તેમના માટે કશું અસાધ્ય નથી. જેમની વાણી મીઠી છે તેઓ કોઈ પણ કામ કરાવી શકે છે. જેઓ ઉદ્યમશીલ છે તેમના માટે કોઈ વસ્તુ અલભ્ય નથી.]

કુલસ્યાર્થે ત્યજેદેકમ્ ગામ્સ્યાર્થે કુલમ્ત્યજેત્।  
ગામં જનપદસ્યાર્થે આત્માર્થે પૃથિવીમ્ ત્યજેત્॥

[મનુસ્મૃતિ અનુસાર કુળના ભલા માટે એકાદ વ્યક્તિને ત્યજવી, ગામના ભલા માટે કુળને ત્યજવું, જનપદ એટલે કે મોટા વિસ્તારના ભલા માટે ગામને ત્યજવું અને આત્માના ઉદ્ધાર માટે સમગ્ર પૃથ્વી ત્યજવી ઈચ્છનીય છે.]

कुसुमं वर्णसंपन्नंगन्धहीनं न शोभते।  
न शोभते क्रियाहीनं मधुरं वचनं तथा॥

[पुष्प रंगमां ભલે ગમે તેટલું સારું હોય પણ સુગંધ વિનાનું હોય તો તે શોભે નહિ. તે જ રીતે જેને અમલમાં ન મૂકવાના હોય તેવા મીઠા વચનો શોભતા નથી.]

कृतस्य करणं नास्ति मृतस्य मरणं तथा।  
गतस्य शोचना नास्ति ह्येतद् वेदविदां मतम्॥

[જે કામ થઈ ગયું તે થઈ ગયું. તે કામ નથી થયું એવું થઈ શકતું નથી. જેમકે કોઈનું મરણ થઈ જાય તે થઈ જાય. તેને પાછું પલટાવી શકાય નહિ. એટલે જ વેદના જાણકારોનો મત છે કે વીતી ગયેલી વાતનો શોક કરવો ન જોઈએ.]

कृपणेन समो दाता न भूतो न भविष्यति।  
अस्पृशन्नेव वित्तानि यः परेभ्यः प्रयच्छति॥

[કૃપણ જેટલો મોટો દાનવીર આ જગતમાં થયો નથી અને થશે નહિ કેમકે કૃપણ પોતાનું બધું ધન આખી જિંદગી સુધી હાથથી સ્પર્શ પણ કર્યા વિના સાચવી રાખીને બીજાને આપી દે છે.]

केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः  
न स्नानं न विलेपनं न कुसुमं नालंकृता मूर्धजाः।  
वाण्येका समलंकरोति पुरुषं या संस्कृता धार्यते  
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्॥

[માણસ શોભે શેનાથી? હાથમાં પહેરેલા સુંદર બાજુબંધથી? ગળામાં પહેરેલા ચંદ્રસમા ઊજળા હારથી? સ્નાનથી મળતી સ્વચ્છતાથી? દેહ પર લગાડેલા વિલેપનથી? પુષ્પોથી? વાળની સરસ ગૂંથણીથી? હા, શોભાની આ બધી ચીજો જરૂર સારી લાગે છે પણ તેનાથી અનેકગણી ચડિયાતી શોભા તેના મુખમાંથી નીકળતી સંસ્કારી વાણીની છે. સંસ્કારપૂર્ણ વાણીની શોભા પાસે અન્ય બધી શોભા આખી પડી જાય છે.]

को न याति वशं लोके मुखे पिण्डेन पूरितः।  
मृदङ्गो मुखलेपेन करोति मधुरध्वनिम्॥

[‘भवऽवो’ तो कोण तमारा वशमां न आवे ? मृदङ्गना मोढे लेप करो तो तेमांथी पण मधुर अवाज आववो शरु थई जाय छे.]

को हि भारः समर्थानां किम् दूरं व्यवसायिनाम्।  
को विदेशः सविद्यानां कः परः प्रियवादिनाम्॥

[ताकातवर माणसने भार उपाऽवो भारे न पडे. धंधो करतो होय तेने कोई स्थल दूर न लागे. जेनी पासे विद्या होय तेने देश के परदेश सरभां ज लागे. जे सरस मीठी वातो करे तेने कोई पारकुं न रहे.]

क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः।  
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

[भगवत गीताना आ श्लोकमां भगवान अर्जुनने उपदेश आपता समजावे छे के क्रोधथी भान भूली जवाय छे. भान भूलेला माणसने याद राખवा जेवी वातो याद आवती नथी. आ विस्मृतिने कारणे मगज काम करतुं नथी अने जेनुं मगज काम न करे तेनुं साव धनोतपनोत नीकणी जाय छे.]

कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ।  
कस्याहं का च मे शक्तिरिति चिन्त्यं पुनः पुनः॥

[अत्यारे संजोगो केवा छे, कोण मारा मित्रो छे, हुं क्या विस्तारमां रहुं छुं, मारी आवक अने भर्य केटला छे, हुं कोण छुं, अने मारी शक्ति केटली छे - आ छ बाबतो दरेक माणसे इरी इरी जोतां रहेवुं जोईये.]

५

खद्योतो द्योतते तावद् यवन्नोदयते शशी।  
उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः॥

[ ज्यां सुधी चंद्रमा उगतो नथी त्यां सुधी आगियो यमके छे. येक वખत सूरज उगे पछी न तो चंद्रनो कोई भाव पूछे के न तो आगियानो कोई पत्तो लागे छे.]

खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु।  
दशाननोऽहरत् सीतां बन्धनं तु महोदधेः॥

[એવું ઘણી વખત બને છે કે કોઈ ખરાબ માણસ ખોટું કામ કરે પણ તેનું ખરાબ પરિણામ સારા માણસે વેઠવું પડે. દશ માથાવાળો રાવણ સીતાનું હરણ કરી ગયો પણ બંધન સમુદ્રને વેઠવાનો વારો આવ્યો.]

ग

गहना कर्मणो गतिः।

[કર્મની ગતિ ગહન છે. સમજી શકાતી નથી.]

गुणवज्जनसंसर्गात् याति नीचोऽपि गौरवम्।  
पुष्पमालाप्रसङ्गेन सूत्रम् शिरसिधार्यते॥

[ગુણવાન માણસોના સંસર્ગમાં રહેવાથી ઓછી લાયકાતવાળા માણસોને પણ ગૌરવ મળી જાય છે. પુષ્પમાલામાં રહેવાને કારણે સાધારણ દોરાને પણ ગળામાં માનભર્યું સ્થાન મળે છે.]

गुणाः पूजास्थानम् गुणिषु, न च वयं, न च लिंगं।

[ભવભૂતિકૃત ઉત્તરરામચરિતમાં આ કથન છે: ગુણવાન માણસોની પૂજા તેની વય કે લિંગના આધાર પર નહિ પણ તેના ગુણ જોઈને કરાય છે.]

गुणैरुत्तमतांयाति नोच्चैरासनसंस्थितः।  
प्रासादशिखरस्थोपि काकः किं गरुडायते॥

[કોઈ પણ માણસની લાયકાત તે ક્યા સ્થાને બિરાજે છે તેના પરથી નહિ પણ તેના ગુણો કેવાં છે તે આધારે જ અંકાય. કોઈ કાગડો ઊડીને ઊંચા મહેલના શિખર પર બેસી જાય એટલે તે ગરુડ થોડો થઈ જાય ?]

ધ

घटं भिन्द्यात् पटं छिन्द्यात् कुर्याद्रासभरोहणम्।

येन केन प्रकारेण प्रसिद्धः पुरुषो भवेत्॥

[ધરના વાસણ ફોડીને, પોતે પહેરેલા કપડાં ફાડીને, ગઘેડા ઉપર સવારી કરીને કે એક યા બીજી કોઈ રીતે (પ્રસિદ્ધિ ભૂખ્યા) માણસો પ્રસિદ્ધિ મેળવે છે જ.]

घृष्टं घृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धम्।

छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकाण्डम्।

दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णम्।

प्राणान्तेऽपि हि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम्॥

[ચંદનને ગમે તેટલી વાર ઘસો પણ તે દરેક વખતે મનોહર સુગંધ જ આપશે. શેરડીમાં ગમે તેટલાં કાપા મૂકો પણ દરેક વખતે તેનો રસ મીઠો ને મીઠો જ રહેશે, સોનાને યાદે તેટલી વાર તપાવો પણ તેનો સોનેરી રંગ ઝાંખો પડશે નહિ. જે ઉત્તમ પ્રકૃતિ ધરાવતા હોય તેઓ મરી જાય પણ કદી પોતાની ઉત્તમ પ્રકૃતિને ન છોડે.]

ચ

चक्रवत्परिवर्तन्ते दुःखानि च सुखानि च।

नीचैर्गच्छत्युपरि च दशा चक्रनेमિક્રમેण॥

[સુખ અને દુઃખ વારાફરતી આવ્યા જ કરે છે. ગોળ ગોળ ફરતા ચકડોળમાં જેમ જે નીચે હોય તે ઉપર આવે અને જે ઉપર હોય તે નીચે જાય તેવું જ સુખદુઃખનું છે. એ ચક્ર ચાલતું જ રહે છે.]

चरैवेति चरैवेति।

[ચાલતા રહે, ચાલતા રહે, ચાલતા રહેવામાં જ કલ્યાણ છે. ચરૈવેતિ ચરૈવેતિ સૂત્રના મૂળ પાંચ સુંદર શ્લોક આ પ્રમાણે હોવાનું મનાય છે:

१-ॐ नाना श्रान्ताय श्रीरस्ति, इति रोहित शुश्रुम।

पापो नृषद्वरो जन, इन्द्र इच्चरतः सखा। चरैवेति चरैवेति॥

२- पुष्पिण्यौ चरतो जंघे, भूष्णुरात्मा फलग्रहिः।  
शरेऽस्यसवेर् पाप्मानः श्रमेण प्रपथे हताः। चरैवेति चरैवेति॥

३- आस्ते भग आसीनस्य, ऊर्ध्वस्तिष्ठति तिष्ठतः।  
शेते निपद्यमानस्य, चराति चरतो भगः। चरैवेति चरैवेति॥

४- कलिः शयानो भवति, संजिहानस्तु द्वापरः।  
उत्तिष्ठस्त्रेताभवति, कृतं संपद्यते चरन्। चरैवेति चरैवेति॥

५- चरन् वै मधु विन्दति, चरन् स्वादुमुदुम्बरम्।  
सूयस्यर्षपश्य श्रेमाणं योर्न तन्द्रयते चरन्। चरैवेति चरैवेति॥ ]

चिन्तनीया हि विपदां आदावेव प्रतिक्रिया।  
न कूपखननं युक्तं प्रदीप्ते वान्हिना गृहे॥

[संकट आवे ते पहेला જ તેનો ઈલાજ વિચારી રાખવો જોઈએ. આગ લાગે પછી ફૂલો ખોદવા ન બેસાય.]

૯

છિન્નોऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनश्चन्द्रः।  
इति विमृशन्तः सन्तः सन्तप्यन्ते न विप्लुता लोके॥

[ભર્તૃહરિના નીતિશતકનો આ શ્લોક છે: વૃક્ષને કાપો તો તે ફરી ફરી વધે છે. ચંદ્ર ક્ષીણ થયા પછી પાછો વધતો જાય છે. આ બધી વાત યાદ રાખી સંત માણસો દુઃખમાં પણ સંતાપ પામતા નથી.]

૯-૩

जयन्तु ते सुकृतिनो रससिद्धाः कवीश्वराः।  
नास्ति एषां यशः काये जरामरणजं भयम्॥

[સુંદર કૃતિઓ રચનારા, ઉરના ઊંડા ભાવને શબ્દમાં ઉતારી રસ સિદ્ધ કરનારા, કવિઓ પણ જેને ઉત્તમ ગણે એવા મહાકવિઓનો જય હો. તેમની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા કે મરણનો કોઈ ભય નથી]

जले तैलं खले गुह्यां पात्रे दानं मनागपि।  
प्राज्ञे शास्त्रं स्वयं याति विस्तार वस्तुशक्तिः॥

[ઘણી બાબતો તેના મૂળભૂત ગુણધર્મને કારણે આપમેળે વિસ્તાર પામે છે. જેમકે પાણીની ઉપર નાખેલું તેલ, દુષ્ટ માણસને કહેવામાં આવેલી ખાનગી વાત, સુપાત્રને આપેલું નાનું સરખું દાન, ડાહ્યા માણસને મળેલું જ્ઞાન આ બધું આપમેળે ફેલાયા કરે છે.]

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।  
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥

[ભગવદ્ ગીતાનો ઉપદેશ: જે માણસ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમનું મરણ થાય તેનો ફરી જન્મ થાય છે. આ વાતને કોઈ માણસ કોઈ કાળે ટાળી શકે નહિ. આવી અનિવાર્ય બાબતનો હરખશોક રાખવો ન જોઈએ.]

जानामि धर्मं न च मे प्रावृत्तिः।  
जानाम्यधर्मं न च मे निवृत्तिः॥

[મહાભારતમાં દુર્યોધન દ્વારા બોલાયેલું પ્રસિદ્ધ વાક્ય ધર્મ શું છે, અધર્મ શું છે તેની મને ખબર નથી એવું નથી. મને બધી ખબર છે. પણ જાણવા છતાં હું ધર્મના માર્ગે કદમ મૂકી શકતો નથી અને અધર્મના માર્ગેથી પાછો ફરી શકતો નથી.]

जीवो जीवस्य जीवनम्।

[આ જગતમાં દરેક જીવનું જીવન બીજા જીવને આધારે જ ચાલે છે.]

ज्येष्ठत्वं जन्मना नैव गुणैर्ज्येष्ठत्वमुच्यते।  
गुणात् गुरुत्वमायाति दुग्धं दधि घृतं क्रमात्॥



[મહાનપણું જન્મથી મળતું નથી ધીમે ધીમે ગુણોના સંચય વડે મહાન થવાય છે. ધીનો જ દાખલો લો. ધી સીધું બનતું નથી દૂધનું દહીં, છાશ, માખણ થયા પછી છેવટે ધી બને છે.]

૨-૬-૩-૬-૧૭

ત-થ

તત્ કર્મ યત્ ન બન્ધાય સા વિદ્યા યા વિમુક્તયે।  
આયાસાય અપરં કર્મ વિદ્યા અન્યા શિલ્પનૈપુણમ્॥

[વિષ્ણુપુરાણનું આ કથન છે. ભાવાર્થ છે કે જે કર્મ મનુષ્યને (ભવના)બંધનમાં ન બાંધે તે સાચું કર્મ છે. જે વિદ્યા (ભવના) બંધનમાંથી મુક્તિ અપાવે તે સાચી વિદ્યા છે. બાકીના કર્મ તો માત્ર કષ્ટનું કારણ બને છે અને બાકીની વિદ્યા ફક્ત શોભાના ગાંઠીયા જેવી છે.]

તદેજતિ તન્નૈજતિ તદ્દરે તદ્વન્તિકે।  
તદન્તરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્ય બાહ્યતઃ॥

(ઈશાવાસ્યોપનિષદ)

[પ્રભુ છે ભમતા ને છતાં સ્થિર અનંત અંતરે ને સાવ નજીક વ્યાપ્યા છે કણેકણની ભીતર છતાં છે સર્વની બહાર સંપૂર્ણ]

તદેતત્ ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણિ શિવે।  
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ॥

[દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રનો સુંદર શ્લોક: હે સર્વનો ઉદ્ધાર કરનારી કલ્યાણકારી દેવી મારા બધા અપરાધની ક્ષમા આપજે કેમકે ક્યારેક પુત્ર કુપુત્ર બને છે પણ માતા કદી કુમાતા બનતી નથી.]

તાવત્ ભયસ્ય ભેતવ્યં યાવત્ ભયં ન આગતમ્।  
આગતં હિ ભયં વીક્ષ્ય પ્રહર્તવ્યં અશંકયા॥

[પંચતંત્રમાં અપાયેલી સોનેરી સલાહ: જ્યાં સુધી ભય સામે ન આવે ત્યાં સુધી ભયથી ડરવું જોઈએ ને એનાથી દૂર રહેવું જોઈએ પણ એક વખત ભય ઉપસ્થિત થાય કે તુરંત અચકાયા વિના તેના પર પ્રહાર કરવો જોઈએ.]

ते हि नो दिवसा गताः।

[ ते દિવસો ગયા જ. ભગવાન રામનો વિષાદયોગ વર્ણવવા ભવભૂતિએ રામના મુખમાં મૂકેલા શબ્દો. ઉત્તરરામચરિતનો આખો શ્લોક આ પ્રમાણે છે.

जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे । मातृभिश्चिन्त्यमानानां ते हि नो दिवसा गताः ॥१२॥

હું પિતાજીના ચરણમાં જીવતો હતો, નવા નવા લગ્ન થયા હતા. મારી માતાઓની સંભાળ રાખતો હતો. તે દિવસો ગયા જ. ભવભૂતિની આ કૃતિ અનેક રીતે અદ્ભુત છે. ભગવાન રામ માટે 'ચંડાળ' શબ્દ વાપરવાની હિમ્મત ભવભૂતિ જેવા કવિ જ કરી શકે. આ કૃતિમાં ભગવાન રામ પોતે જાતે સીતાત્યાગના પ્રસંગને પોતાના 'ચાંડાલકર્મ' તરીકે વર્ણવે છે. આપણાં રમેશ પારેખે પણ પોતાની એક કવિતામાં ઈશ્વરને અસલી કાઠીયાવાડી ભાષામાં 'ગઘેડીનો' કહી પોતાનો આકોશ વ્યક્ત કર્યો છે.]

त्यजन्ति मित्राणि धनैर्विहीनं पुत्राश्च दाराश्च सज्जनाश्च।  
तमर्थवन्तं पुनराश्रयन्ति अर्थो हि लोके मनुषस्य बन्धुः॥

[જ્યારે તમારી પાસે ધન ન હોય ત્યારે તમને તમારા મિત્ર, પુત્ર, પત્ની, નજીકના સગાવહાલા બધા છોડીને ચાલ્યા જાય છે. જો તમારી પાસે ધન આવે તો તેઓ તમારી પાસે પાછા આવે છે. જગતમાં તમારો સાચો સાથીદાર પૈસો જ છે.]

त्यजेत् क्षुधार्ता जननी स्वपुत्रं खादेत् क्षुधार्ता भुजगी स्वमण्डम्।  
बुभुक्षितः किं न करोति पापं क्षीणा जना निष्करुणा भवन्ति॥

[આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યે સેંકડો વર્ષ પૂર્વે લખેલો જગતની કઠોર વાસ્તવિકતાનું નિરૂપણ કરતો આ શ્લોક આજે પણ એટલો જ આંખ ઉઘાડનારો છે: ભૂખના દુઃખની મારી જનેતાને ઘણી વખત પોતાનું સંતાન ત્યાગી દેવાની ફરજ પડે છે. ભૂખી થયેલી સાપણ પોતાના બચ્ચાઓને પણ ખાઈ જાય છે. ભૂખ્યો માણસ ક્યું પાપ ન કરે ? જે માણસની શક્તિ સાવ ખલાસ થઈ જાય તે નિષ્કુર, દયાવિહીણો થઈ જાય.]

त्यजेद् धर्मं दयाहीनं विद्याहीनं गुरुं त्यजेत्।  
त्यजेत् क्रोधमुखीं भार्यां निःस्नेहान् बान्धवांस् त्यजेत्॥

[જેમાં દયાને સ્થાન ન હોય તેવો ધર્મ છોડી દેવો જોઈએ. જેની પાસે વિદ્યા ન હોય તેવા ગુરુનો ત્યાગ કરવો જોઈએ. સદા ક્રોધ કરતી પત્નીને છોડવી જોઈએ અને આપણા માટે સ્નેહભાવ ન ધરાવતા ભાઈને વહેતો મૂકી દેવો જોઈએ.]

ત્રિયાચરિત્રં પુરુષસ્ય ભગ્યં।  
દૈવો ન જાનાતિ કુતો નરમ્॥

[સ્ત્રીના બાહ્ય વર્તનની પાછળ અને પુરુષના ભાગ્યની અંદર શું છૂપાયેલું છે તે દેવો પણ જાણી શકતા નથી તો સાધારણ માણસને તો ક્યાંથી ખબર પડે.]

૬

દર્શને સ્પર્શને વાપિ શ્રવણે ભાષણેઽપિ વા।  
યત્ર દ્રવત્યન્તરઙ્ગં સ સ્નેહ ઇતિ કથ્યતે॥

[જેના દર્શન કરવાથી, જેનો સ્પર્શ થવાથી, જેનું બોલેલું સાંભળતા કે જેને કૈંક કહેવા જતાં તમારું હૃદય ઓગળવા લાગે ત્યારે સમજવું કે તમને તેના માટે સ્નેહના અંકુર ફૂટી ગયા છે.]

દાતા લઘુર્ અપિ સેવ્યો ભવતિ ન કૃપણો મહાન્ અપિ સમૃદ્ધ્યા।  
કૂપોઽન્તઃ સ્વાદુજલઃ પ્રીત્યૈ લોકસ્ય ન સમુદ્રઃ॥

[દાતા ગમે તેટલો નાનો હોય તો પણ માનને લાયક ગણાય. કૃપણ માણસ ગમે તેટલો સમૃદ્ધ હોય છતાં નકામો ગણાય. કુવો નાનો હોવા છતાં પીવા માટે મીઠું પાણી આપે છે. દરિયા પાસે ક્યારે ખૂટે નહિ તેટલો પાણીનો ભંડાર છે પણ તરસ્યાને તે ભંડાર શું કામનો ?]

દાનં ભોગો નાશસ્તિસ્રો ગતયો ભવન્તિ વિક્તસ્ય।  
યો ન દદાતિ ન ભુક્તે તસ્ય તૃતીય ગતિર્ભવતિ॥

[ભર્તૃહરિનું આ કથન છે: દાન, ભોગ અને નાશ એ ત્રણ માર્ગે જ ધન જઈ શકે છે. જે માણસ દાન ન આપે કે ઉપભોગ ન કરે તેનું ધન ત્રીજા માર્ગે જાય છે એટલે કે નાશ પામે છે.]

दुर्जनः परिहर्तव्यः विद्यया अलङ्कृतोऽपि सन्।  
मणिना भूषितः सर्पः किम् असौ न भयङ्करः॥

[दुर्जन માણસ પાસે વિદ્યા ને જ્ઞાનનો ભંડાર હોય તો પણ તેનાથી દૂર રહેવું. નાગની ફેણ પર મણિ હોય એટલે તે કંઈ ઓછો ભયંકર થઈ જતો નથી.]

दुर्जनः प्रियवादीति नैतद्विश्वासकारणम्।  
मधु तिष्ठति जिह्वाग्रे हृदये तु हलाहलम्॥

[દુર્જન માણસ મીઠી મીઠી વાત કરે એટલે તેના પર ભરોસો મૂકી ન દેવાય કેમકે તેની જીભ પર ભલે મધ પાથરેલું હોય પણ તેના દિલમાં નકરું ઝેર જ ભરેલું હોય છે.]

दुर्जनस्य च सर्पस्य वरं सर्पो न दुर्जनः।  
सर्पो दशति कालेन दुर्जनस् तु पदे पदे॥

[દુર્જન અને સર્પ એ બન્નેમાં સર્પ વધુ સારો કેમકે સર્પ તો ક્યારેક દંશ આપે પણ દુર્જન ડગલે પગલે ડંખ્યા જ કરે.]

दुर्जनेन समं सख्यं द्वेषञ्चापि न कारयेत्।  
उष्णो दहति चाङ्गारः शीतः कृष्णायते करम्॥

[દુર્જનો સાથે દોસ્તી કે દુશ્મની કંઈ ન કરાય. કોલસો ગરમ થાય તો હાથ દઝાડે અને ઠંડો થાય તો હાથ કાળા કરે.]

दुर्बलस्य बलं राजा बालानां रोदनं बलम्।  
बलं मूर्खस्य मौनित्वं, चौराणाम् अनृतम् बलम्॥

[દુબળા માણસનું બળ રાજા છે. બાળકોનું બળ રૂદન છે. મુર્ખ માણસનું બળ મૌન છે અને જુઠાણું ચોરનું બળ છે.]

दुष्टस्य दण्डः स्वजनस्य पूजा न्यायेन कोशस्य हि वर्धनं च।  
अपक्षपातः निजराष्ट्ररक्षा पञ्चैव धर्माः कथिताः नृपाणाम्॥

[આદર્શ રાજાની પાંચ ફરજ છે. દુષ્ટ માણસોને દંડ આપવો, પોતાના માણસોની કદર કરવી, ન્યાયપૂર્વક રાજકોષને વધુ સમૃદ્ધ બનાવવો, નિષ્પક્ષપાત વહિવટ ચલાવવો અને પોતાના રાજ્યનું રક્ષણ કરવું.]

दुष्टा भार्या शठं मित्रं भृत्यश्चोत्तरदायकः।  
ससर्पे च गृहे वासो मृत्युरेव न संशयः॥

[પત્ની દુષ્ટ હોય, મિત્ર ધુતારો હોય, નોકર સામું મોઢે સંભળાવનારો હોય અને સાપવાળા ઘરમાં રાત રહેવાનું હોય તો આપણો ઘડોલાડવો થઈ જ જવાનો એ વાત સો ટકા સારી માનજો.]

दूरस्थाः पर्वताः रम्याः वेश्याः च मुखमण्डने।  
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरतः॥

[ડુંગર દૂરથી રળીયામણા લાગે. વારાંગનાનું મુખ આઘેથી સારું દેખાય. લડાઈની વાતો ફક્ત સાંભળવામાં સારી લાગે. આ ત્રણેય આઘા સારા બાકી તેમનો અનુભવ લેવા જઈએ તો ખોખરા થઈ જઈએ.]

दूरस्थोऽपि न दूरस्थो यो यस्य मनसि स्थितः।  
यो यस्य हृदये नास्ति समीपस्थोऽपि दूरतः॥

[આણક્યે સરળ ભાષામાં કહેલું સનાતન સત્યઃ જેનું સ્થાન આપણાં હૈયામાં અવિચળ હોય તે ભલે ગમે તેટલો દૂર હોય પણ તે કદી દૂર હોતો નથી. જેને માટે આપણા હૈયામાં કોઈ સ્થાન નથી તે ભલે આપણી સામે ઊભો હોય પણ તે દૂરનો દૂર જ રહે છે.]

दृष्टिपूतं न्यसेत्पादं वस्त्रपूतं जलं पिबेत्।  
सत्यपूतं वदेद्वाचं मनः पूतं समाचरेत्॥

[આ પણ ચાણક્યનો ઉપદેશ છે: જીવનમાં દરેક પગલું જોઈ જોઈને મૂકવું. પાણી પીવું હોય તો ગાળીને પીવું. જે કંઈ બોલીએ તે સાચું છે કે નહિ તેનો વિચાર કરીને બોલવું અને જીવનમાં જે કંઈ કામ કરીએ તે આપણા મનને પૂછીને કરવા કે હું જે કંઈ કરું છું તે બરાબર છે કે નહિ.]

ધ

ધનધાન્યપ્રયોગેષુ વિદ્યાસઙ્ગ્રહણેષુ ચ।  
આહારે વ્યવહારે ચ ત્યક્તલજ્જસ્સુખી ભવેત્॥

[ધનધાન્ય ભેગા કરવામાં, વિદ્યાપ્રાપ્તિમાં, જમવામાં અને વ્યાવહારિક બાબતોમાં જે માણસ ખોટી શરમ છોડી દે તે સુખી થાય.]

ધર્મો રક્ષતિ રક્ષિતઃ।

[જે ધર્મનું રક્ષણ કરે છે તેનું ધર્મ રક્ષણ કરે છે.]

ધિક્ તસ્ય જન્મ યો લોકે પિત્રા વિજ્ઞાયતે નરઃ।

[જે માણસ પોતાના કાર્યના લીધે નહિ, વડિલોના નામને લીધે જાણીતો બને છે તેનો જન્મ વૃથા છે.]

ન

ન અભિષેકો ન સંસ્કારઃ સિંહસ્ય ક્રિયતે વને।  
વિક્રમાર્જિતસત્ત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા॥

[વનમાં સિંહનો કોઈ વિધિપૂર્વક રાજ્યાભિષેક કરતું નથી. સિંહ સ્વપરાક્રમ વડે જ પોતાને મૃગેન્દ્ર તરીકે પૂરવાર કરે છે.]

ન કશ્ચિત્ કસ્યચિત્ મિત્રં ન કશ્ચિત્ કસ્યચિત્ રિપુઃ।  
કારણેનૈવ જાયન્તે મિત્રાણિ રિપવોઽપિ વા॥

[અમસ્તા અમસ્તા કોઈ કોઈના મિત્ર કે શત્રુ થઈ જતાં નથી. જ્યારે કોઈ કારણ ઉપસ્થિત થાય ત્યારે જ મિત્ર કે શત્રુનો ઉદ્ભવ થાય છે.]

ન કાલસ્ય પ્રિયઃ કશ્ચિન્ન દ્વેષ્યોઽપિ કપીશ્વર।  
કાલઃ કાલયતે સર્વાન્સર્વઃ કાલેન બધ્યતે॥

[કાળને માટે કોઈ પ્રિય કે અપ્રિય નથી. કાળ બધાને ખાઈ જાય છે. બધા લોકો કાળના બંધનમાં બંધાયેલા છે.]

ન ચ વિદ્યાસમો બન્ધુઃ ન ચ વ્યાધિસમો રિપુઃ।  
ન ચાપત્યસમો સ્નેહઃ ન ચ ધર્મો દયાપરઃ॥

[વિદ્યા સમાન કોઈ બંધુ નથી. ચિંતા જેવો કોઈ દુશ્મન નથી. સંતાનપ્રેમ સમો કોઈ સ્નેહ નથી. દયાથી ઊંચો કોઈ ધર્મ નથી.]

ન ચોરહાર્યં ન ચ રાજહાર્યં ન ભ્રાતૃભાજ્યં ન ચ ભારકારી।  
વ્યયે કૃતે વર્ધત એવ નિત્યં વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્॥

[બધા પ્રકારના ધનમાં વિદ્યારૂપી ધન સૌથી ચડે કેમકે ચોર તેની ચોરી કરી શકતા નથી, રાજા તે છીનવી શકતો નથી, ભાઈઓ તેમાંથી પોતાનો ભાઈભાગ પડાવી શકતા નથી, તે બોજરૂપ બનતું નથી, તે વાપરવાથી તે વધે છે અને તેનો કદી નાશ થતો નથી.]

ન જાતુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ।  
હવિષા કૃષ્ણમત્રમેવ ભુય એવાભિવર્ધતે॥

[આપણી ઇચ્છાને આપણે ગમે તેટલી વખત સંતોષીએ પણ તેથી ઇચ્છા શાંત પડી જતી થતી નથી. યજ્ઞની અંદર આહુતિ હોમવાથી અગ્નિનું જોર વધે છે, ઘટતું નથી.]

ન જાયતે મિચતે વા કદાચિન્ નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ।  
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે॥

[ભગવદ્ ગીતામાં ભગવાને આપેલો બોધ: આ આત્મા કોઈ પણ કાળમાં ન જન્મ લે છે ન મરણ પામે છે. ન તો તેનો ઉદ્ભવ કે ફરી ઉદ્ભવ થાય છે. તે નિત્ય છે શાશ્વત છે પુરાતન છે. દેહ હણાઈ જાય છે. આત્મા હણાતો નથી. ]

ન તુ અહં કામયે રાજ્યં ન સ્વર્ગં ન પુનર્ભવમ્।  
કામયે દુઃખતપ્તાનાં પ્રાણિનામ્ આર્તિનાશનમ્॥

[ભાગવત પુરાણમાં રાજા રન્તિદેવ આ શ્લોક કહે છે અને મહાભારતના દ્રોણપર્વમાં પણ તેનો ઉલ્લેખ છે. નથી ઇચ્છા મને રાજ્યની, નથી સ્વર્ગની કે નથી નવો જન્મ ધારણ કરવાની. મારી ઇચ્છા આ જગતના પ્રત્યેક દુઃખી-પીડિત પ્રાણીના દુખદર્દ દૂર કરવાની છે.]

ન દેવા દણ્ડમાદાય રક્ષન્તિ પશુપાલવત્।  
યં તુ રક્ષિતુમિચ્છન્તિ બુદ્ધ્યા સંવિભજન્તિ તમ્॥

[ભરવાડને ઢોરનું રક્ષણ કરવું હોય તો તે હાથમાં લાકડી લઈ ઢોરને બચાવતા હોય છે. ભગવાન તમને ઢોરની કક્ષામાં મૂકતો નથી. એટલે જ્યારે તેને તમારું રક્ષણ કરવું હોય ત્યારે તે હાથમાં લાકડી લઈ બચાવવા આવતો નથી. એ તમને સદ્બુદ્ધિ આપે છે.]

ન ધૈર્યેણ વિના લક્ષ્મીર્ન શૌર્યેણ વિના જયઃ।  
ન જ્ઞાનેન વિના મોક્ષો ન દાનેન વિના યશઃ॥

[ધીરજ ધર્યા વિના લક્ષ્મી ન મળે. શૂરવીરતા દાખવ્યા વિના જીત ન મળે. જ્ઞાન વિના મોક્ષ ન મળે. દાન કર્યા વિના જશ ન મળે.]

ન ભૂતપૂર્વં ન કદાપિ વાર્તા હેમ્નઃ કુરઙ્ગો ન કદાપિ દૃષ્ટઃ।  
તથાપિ તૃષ્ણા રઘુનન્દનસ્ય વિનાશકાલે વિપરીતબુદ્ધિઃ॥

[સોનાના હરણની વાત ન તો કદી કોઈએ સાંભળી હતી ન તો સોનાનું હરણ કોઈએ સગી આંખે જોયું હતું છતાં ભગવાન રામ જેવા પણ એ કાલ્પનિક હરણ પાછળ દોડ્યા ખરેખર જ્યારે દુઃખના દહાડા આવવાના હોય ત્યારે આપણી બુદ્ધિ બહેર મારી જાય છે.]



न भूतो न भविष्यति।

[अशक्य वस्तु જે કદી થઈ નથી અને થશે નહિ.]

न राज्यम् न च राजाः असीत् न दण्डयो न च दाण्डिकः ।

धर्मणैव प्रजाः सर्वा रक्षन्ति स्मः परस्परम् ॥

[કાર્લ માર્ક્સે સામ્યવાદના સિદ્ધાંતો ઘડતી વખતે સામ્યવાદમાં છેવટના તબક્કે રાજ્યની તમામ સત્તા વિલીન થઈ જશે એવી જે કલ્પના ઘડી તેના પ્રેરણાદાતા હતા રશિયાના પ્રિન્સ ક્રોપોટકીનના રાજ્યવિહીન સમાજરચનાના મૂળભૂત વિચારો. પણ પ્રિન્સ ક્રોપોટકીન કહે તે પહેલા સંસ્કૃત સાહિત્યમાં અનેક સદીઓ અગાઉ એ જ વાત વર્ણવાઈ ચૂકી છે. મહાભારતના શાંતિ પર્વના આ શ્લોકમાં બ્રાણશૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહે છે કે ન કોઈ રાજ્ય હોવું જોઈએ કે ન કોઈ રાજા, ન કોઈ દંડ કે સજા કરનાર હોવું જોઈએ કે ન કોઈ દંડ કે સજા ભોગવનાર. ધર્મ (એટલે કે પોતાના કર્તવ્યના પાલન) વડે સર્વ પ્રજાએ એક બીજાનું રક્ષણ કરવું ઘટે છે.]

न हि कल्याणकृत्कश्चिद्दुर्गतिं तात गच्छति।

[ભગવદ્ ગીતામાં ભગવાનનો ઉપદેશ: કલ્યાણકારી કામ કરનારની કોઈ દિવસ અવદશા થતી નથી.]

न हि कश्चिद् आचारः सर्वहितः संप्रवर्तते।

[આ જગતમાં એવો કોઈ સમાજ નિયમ હજુ સુધી ઘડાયો નથી કે જેનાથી બધાને એક સરખો ફાયદો થાય. એટલે જ લોકશાહીમાં પણ maximum good of maximum people ની જ વાત થાય છે.]

न हि कस्य प्रियः को वा विप्रियो वा जगत् त्रये।

काले कार्यवाशात् सर्वे भवन्त्य् एवाप्रियाः प्रियाः ॥

[ત્રણે જગતમાં કોઈ કોઈનું વહાલું નથી કે નથી કોઈ કોઈનું દવલું. સમય અને સંયોગો અનુસાર સર્વે એક બીજાને ગમતા કે અણગમતા થાય છે.]

न हि ज्ञानेन सदृशम् पवित्रमिह विद्यते।  
तत्स्वयं योगसंसिद्धिः कालेनात्मनि विन्दति॥

[આ સંસારમાં જ્ઞાન જેટલી પવિત્ર ચીજ બીજી કોઈ નથી. કર્મયોગ વડે સંસિદ્ધિ મેળવ્યા પછી સમયના વીતવા સાથે તે આત્મામાં સ્વયં પ્રગટ થાય છે.]

नमन्ति फलिनो वृक्षा नमन्ति गुणिनो जनाः।  
शुष्ककाष्ठश्च मूर्खश्च न नमन्ति कदाचन॥

[ફળ આવવાથી વૃક્ષો નીચા નમે છે. ગુણો પ્રાપ્ત થતાં માણસો બીજાને નમન કરતાં થાય છે. માત્ર સૂકા લાકડાં અને મૂર્ખ માણસો જ બીજાને નમન કરતાં નથી.]

नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके।  
जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन॥  
इति महति विरोधे विद्यमाने समाने।  
नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता॥

[રાજાનું હિત કરનારાએ સામાન્ય પ્રજાનો રોષ વહેરી લેવો પડે છે. સામાન્ય પ્રજાનું હિત કરવા જનારને રાજા રજા આપી દે છે. આમ બન્ને પ્રકારના વિરોધનો સામનો કરીને રાજા તથા પ્રજા બન્નેનું હિત કરી શકે તેવા અમલદાર મળવા દુર્લભ છે.]

नरस्य आभरणं रूपं रूपस्य आभरणं गुणः।  
गुणस्य आभरणं ज्ञानं ज्ञानस्य आभरणं क्षमा॥

[માનવનું આભૂષણ રૂપ છે. રૂપનું આભૂષણ ગુણ છે. ગુણનું આભૂષણ જ્ઞાન છે અને જ્ઞાનનું આભૂષણ ક્ષમા છે.]

नरो वा कुंजरो वा।

[સત્યવક્તા યુધિષ્ઠિર દ્વારા બોલાયેલું પહેલું અને છેલ્લું અર્ધસત્ય. કોણ મરાયું એવા દ્રોણાચાર્યના પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે: અશ્વસ્થામા મરાયો. કદાચ માનવી કદાચ હાથી. આના પરથી કોઈ પણ અસ્પષ્ટ વાત નરો વા કુંજરો વા તરીકે ઓળખાય છે.]

नाक्षरं मंत्ररहीतं नमूलंनौषधिम्।  
अयोग्य पुरुषं नास्ति योजकस्तत्रदुर्लभः॥

[એવો કોઈ અક્ષર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, વનસ્પતિનું એવું કોઈ મૂળીયું નથી કે જેમાં ઔષધશક્તિ ન હોય, એવો કોઈ માણસ નથી કે જે કોઈ કામનો ન હોય. પણ આ બધાનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવા માણસ મળવા દુર્લભ છે.]

नास्ति भार्यासमं किञ्चिन्नरस्यार्तस्य भेषजम्॥

[દુઃખી-પીડિત પતિ માટે પત્નીથી વધુ સારું ઔષધ બીજું કોઈ નથી!]

नास्ति विद्या समं चक्षू नास्ति सत्य समं तपः।  
नास्ति राग समं दुःखम् नास्ति त्याग समं सुखम्॥

[જ્ઞાન જેવા ચક્ષુ નથી, સત્ય સમાન કોઈ તપ નથી. મોહમાયા જેવું કોઈ દુઃખ નથી. ત્યાગ સમાન કોઈ સુખ નથી.]

नायमात्मा प्रवचनेन लभ्यो न मेधया न बहुना श्रुतेन।  
यमेवैष वृणुते तेन लभ्यः तस्यैष आत्मा विवृणुते तन्नू स्वाम् ॥

[કહોપનિષદનો પાંચમો શ્લોક: આત્મસિદ્ધિ એટલે કે આત્મજ્ઞાન કેવી રીતે મળે? પ્રવચનો સાંભળવાથી? બુદ્ધિના પેચ લડાવવાથી ? અનેક વિદ્વાનો, સાધુ. સંતો પાસેથી બોધ મેળવવાથી? ના. કોઈ કોઈને આત્મજ્ઞાન આપી શકતું નથી. આત્મા જ અરજી કરનારો છે અને આત્મા જ અરજી સ્વીકારનારો છે. જેનો આત્મા પોતાની અરજ સ્વીકારે ત્યાં આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.]

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः स्थिरा भवतु गच्छतु वा यथेष्टम्।  
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः॥

[નિષ્ણાત માણસો નિંદા કરે કે વખાણ કરે, ધન-સંપત્તિ ટકે કે ચાલી જાય, મરણ હમણાં આવે કે પછી પણ ધૈર્યવાન માણસો ન્યાયના પંથથી વિચલિત થતા નથી.]

निर्धनस्य कुतः सुखम्।

[निर्धन માણસને સુખ ક્યાંથી હોય.]

निर्विषेणापि सर्पेण कर्तव्या महति फणा।

विषमस्तु न चाप्यस्तુ फटाटोपो भयंकरः॥

[પંચતંત્રનો આ બોધ છે: બિનઝેરી સાપે પણ સ્વરક્ષણ માટે મોટી ફેણ ફેલાવી રાખવી જોઈએ. સાપ ઝેરી હોય કે બિનઝેરી પણ ફેણનો ડર લોકોને લાગતો જ હોય છે.]

नेति नेति।

[આપણી ઉપનિષદોનો મત એવો છે કે ઈશ્વર શું છે, કેવો છે એ જાણવું લગભગ અશક્ય છે કેમકે માનવબુદ્ધિ, સમજણશક્તિ ત્યાં સુધી પહોંચી શકતી નથી. તેના બદલે ઈશ્વર શું નથી એ પ્રમાણમાં સરળતાથી કહી શકાય એટલે 'આ નહિ, આ નહિ' એવા નકારાત્મક વચનો વડે તેના સુધી પહોંચવાની કોશિશ કરવી જોઈએ.]

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥

[શ્રીમદ્ ભગવદ્ ગીતોનો ખૂબ લોકપ્રિય શ્લોક: આત્માને શસ્ત્ર કાપી શકતા નથી. અગ્નિ બાળી શકતો નથી. જળ ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.]

૫-૬

परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः।

परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदम् शरीरम्॥

[પરોપકાર માટે વૃક્ષ ફળ આપે છે. પરોપકાર માટે નદી પાણી વહાવે છે. પરોપકાર માટે ગાય દૂધ આપે છે. આપણું શરીર પરોપકાર માટે જ બનેલું છે.]

परोपदेशवेलायां शिष्टाः सर्वे भवन्ति वै।  
विस्मरन्तीह शिष्टत्वं स्वकार्ये समुपस्थिते॥

[अन्यने उपदेश आपती वખते नियमपालनની વાતો બધા કરે છે પણ એ નિયમપાલનની વાત જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યાં હવામાં ઊડી જાય છે.]

परोपदेशे पांडित्यं सर्वेषां सुकरं नृणाम्।  
धर्मं स्वीयमनुष्ठानं कस्यचित् सुमहात्मनः॥

[બીજાને ઉપદેશ દેવા માટે પોતાના ડહાપણનો ભંડાર ખોલવો એ બહુ સહેલી વાત છે. પરંતુ તે ઉપદેશ પર જાતે આચરણ કરી બતાવવું એ તો કોઈ મહાત્મા જ કરી શકે.]

परोऽपि हितवान् बन्धुः बन्धुरपि अहितः परः।  
अहितो देहजो व्याधिः हितम् आरण्यमौषधम्॥

[હિતોપદેશનો શ્લોક છે. પારકો માણસ આપણું હિત કરે તો તેને સગા ભાઈ જેવો ગણવો. સગો ભાઈ આપણું અહિત કરે તો પારકા જેવો ગણવો. આપણા દેહમાં રહેતો રોગ આપણો હોવા છતાં અહિત કરે છે. દૂર જંગલમાં રહેતું ઔષધ આપણું હિત કરે છે.]

पातुं न प्रथमं व्यवस्यति जलं युष्मास्वपीतेषु या  
नादत्ते प्रियमण्डनापि भवतां स्नेहेन या पल्लवम्।  
आद्ये वः कुसुमप्रसूतिसमये यस्या भवत्युत्सवः  
सेयं याति शकुंतला पतिगृहं सर्वैरनुजायताम्॥

(અભિજ્ઞાન શાકુંતલમ્ - અંક ચોથો)

[ન ચાખ્યું કદી જળનું ટીપું પૂર્ણ તૃપ્ત કર્યા વિના તમને ગમતું છતાં ન ચૂંટતી કદી પર્ણ કોમળ તમારું શાખેથી ડાળે નવું એક ફૂલ બેસે તો ઉત્સવ સમ હર્ષ જેના હૈયે એ શકુંતલાને આપો અનુજ્ઞા હે વૃક્ષો સૌ પતિગૃહે જવાની]

पिण्डे पिण्डे मतिर्भिन्ना कुण्डे कुण्डे नवं पयः।  
जातौ जातौ नवाचाराः नवा वाणी मुखे मुखे॥

[દરેક માણસ પોતાની રીતે વિચારે છે. દરેક કુંડમાં અલગ અલગ પ્રકારનું પાણી હોય છે. દરેક જાતના લોકના રિવાજ જુદા હોય છે. દરેક માનવીના મોઢામાંથી અવનવી વાણી સાંભળવા મળે છે.]

पिबन्ति नद्यः स्वयम् एव न अम्भः।  
स्वयं न खादन्ति फलानि वृक्षाः॥  
न अदन्ति सस्यं खलु वारिवाहा।  
परोपकाराय सतां विभूतयः॥

[નદી પોતાનું પાણી પીતી નથી. વૃક્ષ પોતાના ફળ ખાતા નથી. ખેતરમાં થયેલા પાકના ઢગલા અનાજ ખાઈ જતા નથી. સંત માણસોની સિદ્ધિ-સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.]

पुरा कवीनां गणना प्रसङ्गे कनिष्ठिकाधितिष्ठित कालिदासः।  
अद्यापि तत्तुल्य कवेराभावात् अनामिका सार्थवती बभूव॥

[અગાઉ જ્યારે કવિ કેટલા તેની ગણતરી થતી ત્યારે સૌ પહેલું કાલિદાસનું નામ સૌથી નાની આગળી પર લેવાતું હતું પણ પછી બીજી આંગળી આગળ ગણતરી અટકી જતી હતી. હજુ સુધી કોઈ કવિ કાલિદાસની કક્ષાનો ન જણાયો નથી તેથી એ આંગળીનું ‘અનામિકા’ નામ સાર્થક બની ગયું છે.]

पुराणमित्येव न साधु सर्वं न चापि काव्यं नवमित्यवद्यम्।  
सन्तः परीक्ष्यान्यतरद्भजन्ते मूढः परप्रत्ययनेयबुद्धिः॥

[કાલિદાસ કૃત માલવિકાગ્નિમિત્રમ્નો આ શ્લોક છે. જે જુનું છે તે બધું સારું જ છે એવું માની ન લેવાય. કવિતા નવી હોય એટલે સારી જ હોય તેવું નથી. ડાહ્યા માણસો બરાબર ચકાસણી કર્યા પછી જ નિર્ણય પર આવે છે પણ મૂઢ માણસો બીજાની બુદ્ધિથી દોરવાય છે.]

पुस्तकस्था तु या विद्या परहस्तगतं धनं।  
कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम्॥

[ચોપડીમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું આપણું ધન જ્યારે ખરી જરૂર પડે ત્યારે કંઈ કામમાં ન આવે એટલે તે હોય કે ન હોય બન્ને સરખું જ છે.]

પૃથ્વીવ્યાં ત્રીણિ રત્નાનિ જલમ્ અન્નમ્ સુભાષિતમ્।  
મૂઠૈઃ પાષાણખણ્ડેષુ રત્નસંજ્ઞા પ્રદીયતે॥

[પૃથ્વી પર ત્રણ રત્ન છે: જળ, અન્ન અને સુભાષિત. પણ મૂઠ માણસો પથ્થરના ટૂકડાંને રત્નનું નામ આપે છે.]

પ્રથમગ્રાસે મક્ષિકાપાતઃ।

[પહેલા કોળીયે જ માખી આવી !]

પ્રથમવયસિ પીતં તોયમલ્પમ્ સ્મરન્તઃ શિરસિ  
નિહીતભારાઃ નારીકેલા નરાણામ્ દદતિ।  
જલમનલ્પાત સ્વાદમાજિવીતાન્તમ્  
નહી કૃતમુપકારં સાધવો વિસ્મરન્તિ॥

[નાળિયેરનું ઝાડ પોતાને અગાઉ પીવા મળેલું થોડું પાણી યાદ રાખે છે અને તેને સ્વાદિષ્ટ બનાવી શિર પર ધારણ કરે છે. સજ્જન માણસો પોતા પર કોઈએ કરેલો ઉપકાર કદી ભૂલી જતાં નથી.]

પ્રથમે નાર્જિતા વિદ્યા દ્વિતીયે નાર્જિતં ધનં।  
તૃતીયે નાર્જિતં પુણ્યં ચતુર્થે કિં કરિષ્યતિ॥

[જીવનમાં વિદ્યાર્થી અવસ્થામાં ભણ્યા નહિ. ગૃહસ્થાશ્રમના સમયમાં કમાયા નહિ, વાનપ્રસ્થાશ્રમના સમયે સમાજસેવા કરી પુણ્ય ન કમાયા તો ચોથા સંન્યસ્તાશ્રમમાં કઈ વસ્તુનો ત્યાગ કરશો ?]

પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમન્તિ મધ્યાઃ।  
વિઘ્નૈઃ પુનઃ પુનર્ અપિ પ્રતિહન્યમાનાઃ પ્રારબ્ધમ્ ઉત્તમ જના ન પરિત્યજન્તિ॥

[આ કામ કરવામાં મુશ્કેલી આવશે એવા ડરથી તુચ્છ માણસો કામ શરૂ જ કરતા નથી. મધ્યમ કક્ષાના માણસો કામ તો શરૂ કરે છે પણ મુશ્કેલી આવે તો અધવચ્ચેથી છોડી દે છે. ઉત્તમ માણસો કામ શરૂ કરે છે અને જેટલી વાર મુશ્કેલી આવે તેટલી વાર તેનો મુકાબલો કરતા રહી તેને પૂરું કર્યા પછી જ છોડે છે.]

પ્રિયવાક્ય પ્રદાનેન સર્વે તુષ્યન્તિ જન્તવઃ।  
તસ્માત્ તદેવ વક્તવ્યં વચને કા દરિદ્રતા॥

[દરેક જીવને મીઠી વાણી વડે સંતોષ આપી શકાય છે માટે જીભ મીઠી રાખવી. મીઠા શબ્દો વાપરવામાં ગરીબાઈ શા માટે બતાવવી ?]

બ

બહુજનહિતાય બહુજનસુખાય।

[આ લોકશાહી આદર્શ આપણે ત્યાં સદીઓથી પ્રચલિત છે. જે કામ વધુમાં વધુ માણસોના હિતમાં હોય અને વધુમાં વધુ માણસોને સુખ આપી શકે તે કામ ઉત્તમ કાર્ય કહેવાય.]

બહુરત્ના વસુન્ધરા।

[ આ ધરતીમાં અનેક રત્નો પડ્યાં છે.]

બુદ્ધિર્યસ્ય બલં તસ્ય।

[જેની બુદ્ધિ તેનું બળ]

મ

ભજ ગોવિન્દં ભજ ગોવિન્દમ્ ગોવિન્દં ભજ મૂઢમતે।

સમ્પ્રાપ્તે સન્નિહિતે કાલે ન હિ ન હિ રક્ષતિ ડુકૃત્ કરણે॥



[શંકરાચાર્યનો આ બોધ છે. ગોવિન્દને ભજ, ગોવિન્દને ભજ, હે મૂઢ માણસ, અંતિમકાળે તેના સિવાય અન્ય કોઈ તારું રક્ષણ નહિ કરી શકે.]

મો દારિદ્ર્ય નમસ્તુભ્યં સિદ્ધોઽહં ત્વત્પ્રસાદતઃ।  
પશ્યામ્યહં જગત્સર્વં ન માં પશ્યતિ કશ્ચન॥

[હે દારિદ્ર, તારો પરચો બહુ ભારી છે. તારા પ્રતાપે હું સિદ્ધ પુરુષ બની ગયો છું. હું આખા જગતને જોઈ શકું છું પણ આખા જગતમાં કોઈને હું દેખાતો નથી. (કેમકે મને જોતાવેંત બધા મોઢુ ફેરવીને ચાલતા થઈ જાય છે !)]

મોગાઃ ન મુક્તા વયમેવ મુક્તાઃ।  
તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાઃ॥

[મોગ ભોગવાતા નથી, આપણે જ ભોગવાઈ જઈએ છીએ. તૃષ્ણા કદી વૃદ્ધ થતી નથી, આપણે જ વૃદ્ધ થઈ જઈએ છીએ.]

મ્રમન્ વનાન્તે નવમંજરીષુ ન ષટ્પદો ગન્ધફલીમજિઘ્રત્।  
સા કિં ન રમ્યા સ ચ કિં ન રન્તા બલીયસી કેવલમીશ્વરેચ્છા॥

[વનમાં ફરી ફરીને નવા તાજા પુષ્પ પર બેસતો ભ્રમર ગંધફલી (વનચંપો?)ને સુંઘતો પણ નથી શું તે સુંદર નથી ? શું ભ્રમર આતુર નથી ? ખરેખર, ઈશ્વરની ઇચ્છા જ બળવાન છે.]

મુ

મધુરેણ સમાપયેત્।

[કોઈ પણ કાર્યની પૂર્ણાહુતિ મીઠાશથી કરવી જોઈએ.]

મન એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ।  
બન્ધાય વિષયાસક્તં મુક્ત્યૈ નિર્વિષયં સ્મૃતમ્॥

[મનુષ્ય મનના કારણે બંધનમાં પડે છે અને મન વડે બંધનમુક્ત બને છે. ભોગમાં આપણી આસક્તિ બંધન ઊભા કરે છે. એ આસક્તિને છોડવાથી મુક્તિ મળે છે.]

મનસા ચિન્તિતંકર્મ વચસા ન પ્રકાશયેત્।  
અન્યલક્ષિતકાર્યસ્ય યતઃ સિદ્ધિર્ન જાયતે॥

[ભારતના સૌથી વધુ સફળ રાજનીતિજ્ઞ ચારાક્યની આ સોનેરી સલાહ ભારત કરતાં અન્ય દેશોના રાજનીતિજ્ઞ વધુ સારી રીતે પાળે છે ! ચારાક્ય કહે છે કે આપણે શું કરવાના છીએ, આપણી યોજના શું છે તે વિશે બોલ બોલ ન કરાય. જો કોઈ હરીફને આપણી યોજનાની ખબર પડી જાય તો તે થોડો આપણને સફળ થવા દે ?]

મન્ત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરૌ।  
યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ ભવતિ તાદૃશી॥

[ઘણી વસ્તુ એવી હોય છે જેમાં આપણી જેવી ભાવના હોય તેવી સિદ્ધિ મળે. મંત્રનો જાપ કરવામાં, તીર્થમાં જઈ દર્શન કરવામાં, બ્રાહ્મણ પાસે ક્રિયાકર્મ કરાવવામાં, જોશી પાસે જોશ જોવડાવવામાં, ઔષધનું સેવન કરવામાં, ગુરુ પાસેથી જ્ઞાન મેળવવામાં આપણી ભાવના જેટલી વધુ સારી એટલો વધુ લાભ થાય. આપણને શ્રદ્ધા ન હોય તો કોઈ ફાયદો ન થાય.]

મર્કટસ્ય સુરાપાનં તસ્ય વૃશ્ચિકદંશનમ્।  
તન્મધ્યે ભૂતસંચારો યદ્વા તદ્વા ભવિષ્યતિ॥

[એક તો જાતનું વાંદરું, એમાં દારુ પીધો, પાછો એને વીંછી કરડ્યો અને તે ઉપરથી એને ભૂતના ભડકા પણ દેખાયા. પછી તેના તોજ્ઞાનમાં બાકી શું રહે ?]

મહાજનસ્ય સંસર્ગઃ કસ્ય નોન્નતિકારકઃ।  
પદ્મપત્રસ્થિતમ્ તોયમ્ ધત્તે મુક્તાફલશ્રિયમ્॥

[ઉત્તમ માણસોના સંસર્ગમાં આવવાથી કોની ઉન્નતિ થતી નથી. કમળના પુષ્પ પર રહેલું પાણીનું સાધારણ ટીપું પણ સાચા મોતીની જેમ દીપી ઊઠે છે.]

मा दद्यात् खलसङ्घेषु कल्पनामधुरागिरः।  
यथा वानरहस्तेषु कोमलाः कुसुमस्रजः॥

[દુષ્ટ માણસને સૌજન્યપૂર્ણ વાણી વડે સમજાવવાનો કોઈ અર્થ નથી. વાંદરાના હાથમાં સુકોમળ પુષ્પનો ગુચ્છ મૂકીએ તો તેથી તેના વર્તનમાં કોઈ ફરક પડે ?]

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।  
यत्क्रौञ्चमिथुनादेकम् अवधीः काममोहितम्॥

[વાલ્મિકી રામાયણનો પ્રથમ શ્લોક. કામમોહિત થયેલા ક્રૌંચ પક્ષીની જોડીને ખંડિત કરનારા ઓ શિકારી શાશ્વત સમય સુધી તને અપયશ મળશે. એવું મનાય છે કે ક્રૌંચવધ થતો જોઈ તે સમયે તપ કરી રહેલા વાલ્મિકી ઋષિમાં કવિત્વ જાગ્યું અને તેમાંથી રામાયણ મહાકાવ્ય રચાયું.]

माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः।  
सभामध्ये न शोभते हंसमध्ये बको यथा॥

[જે માબાપ પોતાના સંતાનને ભણાવે નહિ તે તેના દુશ્મન છે. જેમ હંસની વચ્ચે બગલું ન શોભે તેમ આવું અભણ સંતાન સમાજમાં શોભતું નથી.]

मुखं प्रसन्नं विमला च दृष्टिः कथानुरागो मधुरा च वाणी।  
स्नेहोऽधिकः सम्भ्रम दर्शनं च सदानुरक्तस्य जनस्य चिह्नम्॥

[મુખ પર પ્રસન્નતા લહેરાતી હોય, દ્રષ્ટિમાં વિમળતા હોય, પ્રિયપાત્ર વિશેની વાત સાંભળવી ગમતી હોય, મોઢેથી મધુર શબ્દ નીકળતા હોય, સૌ પર વહાલ વરસાવાઈ જતું હોય, બેધ્યાન થઈ જવાતું હોય, એ બધા પ્રેમમાં અનુરાગી બની ગયાના લક્ષણ છે.]

मुर्खा यत्र न पूज्यते धान्यं यत्र सुसंचितम्।  
दंपत्यो कलहः नास्ति तत्र श्रीः स्वयमागतः॥

[જ્યાં મૂર્ખાઓને માન-પાન મળતું નથી, અનાજ અને ખાદ્યપદાર્થ સારી રીતે સાચવીને રાખવામાં આવે છે અને પતિ-પત્ની કંકાસથી દૂર રહે છે ત્યાં સમૃદ્ધિ સામેથી ચાલીને આવે છે.]

મૂર્ખસ્ય પંચ ચિહ્નાનિ ગર્વો દુર્વચનં તથા।  
ક્રોધશ્ચ દ્વધવાદશ્ચ પરવાક્યેષ્વનાદરઃ॥

[મૂર્ખ માણસના પાંચ લક્ષણ છે. અભિમાન, અભદ્ર શબ્દોનો ઉપયોગ, ક્રોધ, હું જ સાચો છું એવો દ્રઢ આગ્રહ અને બીજા જે કંઈ કહે તેનો અનાદર કરવો.]

મૂલોનાસ્તિ કૃતોઃ શાખા।

[જે આડને મૂળ જ ન હોય તેને ડાળી ક્યાંથી ફૂટે ?]

મૃગા મૃગૈઃ સંગમુપવ્રજન્તિ ગાવશ્ચ ગોભિસ્તુરગાસ્તુરંગૈઃ।  
મૂર્ખાશ્ચ મૂર્ખૈઃ સુધયઃ સુધીભિઃ સમાનશીલવ્યસનેષુ સખ્યં॥

[હરણ હરણાંની પાછળ દોડે છે, ગાય ગાયની સાથે જાય છે, ઘોડાને ઘોડા ગમે છે. મૂર્ખને મૂર્ખ તથા બુદ્ધિમાનને બુદ્ધિમાન પસંદ પડે છે. જેમની આદત સરખી હોય તેમની વચ્ચે મૈત્રી સર્જાય છે.]

ય

યત્ર નાર્યઃ તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ।  
યત્ર ઇતાઃ તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્ર અફલાઃ ક્રિયાઃ॥

[મનુસ્મૃતિનું આ કથન છે જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સ્ત્રીઓનું માન-સન્માન જળવાતું હોય ત્યાં દેવતા રાજીના રેડ થઈ રહે છે પણ જ્યાં આમ ન થાય ત્યાં કરવામાં આવેલા બધાં ધાર્મિક ક્રિયાકાંડ નિષ્ફળ જાય છે.]

યથા ધરઃ ચન્દનભારવાહી ભારસ્ય વેતા ન તુ ચન્દનસ્ય।  
એવં હિ શાસ્ત્રાણિ બહૂન્યધીત્ય અર્થેષુ મૂઢાઃ ધરવદ્વહન્તિ॥

[ચંદન ઉપાડી લઈ જતો ગઘેડો માત્ર બોજ ઉપાડી લઈ જતો હોય છે, ચંદન નહિ કેમકે ચંદન શું છે તેની તેને ખબર જ હોતી નથી તેમ ગોખણપટ્ટી કરી સમજ્યા વિના શાસ્ત્ર ભણી ગયેલા લોકો ગઘેડાની માફક માત્ર જ્ઞાનનો બોજ ઉપાડી ફર્યા કરે છે.]

યથા દેશસ્તથા ભાષા યથા રાજા તથા પ્રજા।  
યથા ભૂમિસ્તથા તોયં યથા બીજસ્તથાંકુરઃ॥

[જેવો દેશ તેવી ભાષા, જેવો રાજા તેવી પ્રજા. જેવી ભૂમિ તેવું પાણી અને જેવું બીજ તેવો અંકુર.]

યથા બીજં વિના ક્ષેત્રમ્ ડસં ભવતિ નિષ્ફલમ્।  
તથા પુરુષ કારેણ વિના દૈવં ન સિધ્યતિ॥

[જેમ ખેતરને સારી રીતે ખેડ્યા વિના બીજ વાવી દઈએ તો તે ઊગતું નથી તેમ મહેનત ન કરિયે તો આપણા નસીબમાં લખેલી ચીજ પણ ન મળે.]

યથા મધુ સમાદત્તે રક્ષન્ પુષ્પાણિ ષટ્પદઃ।  
તદ્વદર્થાન્ મનુષ્યેભ્યઃ આદયાત્ અવિહિંસયા॥

[જેમ ભ્રમર પુષ્પોની પૂરતી સંભાળ રાખીને હળવેથી તેની પાસેથી મધ ખેંચે છે તેમ પ્રજા પાસેથી તેને ત્રાસ આપ્યા વિના કરવેરા વડે ધન એકઠું કરવું જોઈએ.]

યથા શિખા મયૂરાણાં નાગાનાં મણયો યથા।  
તદ્ વેદાંગશાસ્ત્રાણાં ગણિતં મૂર્ધ્નિ વર્તતે॥

[જેમ મોરના માથે કલગી શોભે છે અને અને નાગના મસ્તક પર મણિ ઝગમગે છે તેમ વેદાંગશાસ્ત્રમાં ગણિત ટોચના સ્થાને બિરાજે છે.]

યથા હિ એકેન ચક્રેણ ન રથસ્ય ગતિર્ભવેત્।  
એવં પુરુષકારેણ વિના દૈવં ન સિધ્યતિ॥

[પ્રારબ્ધ અને પુરુષાર્થરૂપી બન્ને ચક્ર સાથે ચાલે તો જ સંસારનો રથ આગળ ચાલે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પંગુ બની જાય. એક પૈડાવાળો રથ દોડી ન શકે.]

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारतः।  
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥  
परित्राणाय साधूनां विनाशाय च दुश्कृताम्।  
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥

[જ્યારે જ્યારે ધર્મની જ્યોત ઝાંખી પડશે ત્યારે ધર્મના ઉદ્ધાર માટે હું મારું સર્જન કરીશ. સજ્જનોના રક્ષણ માટે અને ખોટા કાર્યો કરનારાના નાશ માટે તથા ધર્મને ફરી સ્થાપિત કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરીશ.]

यस्तु सञ्चरते देशान् सेवते यस्तु पण्डितान्।  
तस्य विस्तारिता बुद्धिस्तैलबिन्दुरिवाम्भसि॥

[જે માણસ દેશવિદેશનું પર્યટન કરે છે, જ્ઞાની-પંડિતો પાસે જઈ તેની વાત સાંભળે છે તેની બુદ્ધિ પાણી પર પડેલા તેલના ટીપાંની માફક વિસ્તાર પામે છે.]

यस्तु सर्वाणि भूतान्यात्मनेवानुपश्यति।  
सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते॥  
यस्य सर्वाणिभूतान्यात्मैवाभद्विजानतः।  
तत्र को मोहः कः शोकः एकत्व मनुपश्यतः ॥

[ઈશાવાસ્ય ઉપનિષદનું બ્રહ્મજ્ઞાન: જે એવું વિચારી શકે કે આ જગતના સર્વ જીવમાં હું છું અને મારામાં સર્વ જીવ સમાયેલા છે તે અભય પ્રાપ્ત કરે છે. જેમના માટે જગતના સર્વે જીવ પોતાના આત્મા જેવા છે એવા એકત્વદર્શિને મોહ કે શોક સ્પર્શી શકતા નથી.]

यस्मिन् देशे न सम्मानो न प्रीतिर्न च बान्धवाः।  
न च विद्याऽऽगमः कश्चित् तं देशं परिवर्जयेत्॥

[જે દેશમાં આપણું માન ન જળવાતું હોય, આપણા માટે કોઈને લાગણી ન હોય, કોઈ સગા-સંબંધી હોય અને ન તો કંઈ શીખવા-જાણવા મળતું હોય તે દેશને વહેલી તકે છોડી દેવો જોઈએ.]

यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम्।  
लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति॥

[જે માણસ પાસે પોતાની બુદ્ધિ જ ન હોય તેને શાસ્ત્રનું જ્ઞાન શું કામ આવે? જે માણસ પાસે જોવા માટે આંખ ન હોય તેને આરીસો શું કામનો?]

यस्यास्ति वित्तं स वरः कुलीनः स पण्डितः स श्रुतवान् गुणज्ञः।  
स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते॥

[જે મુરતિયા પાસે ધન હોય તે આપમેળે સારા કુળનો, જ્ઞાની, સુશિક્ષિત અને ગુણોનો જાણકાર બની જાય છે. તે જ સારો વક્તા અને દર્શનલાયક ગણાય છે. બધા ગુણ સુવર્ણમાં આવી સમાઈ જાય છે.]

यः पठति लिखति पश्यति परिपृच्छति पण्डितान् उपाश्रयति।  
तस्य दिवाकरकिरणैः नलिनीदलमिव विस्तारिता बुद्धिः॥

[જે માણસ વાંચે છે, લખે છે, બારીકાઈથી નિરીક્ષણ કરે છે, જાણકારી મેળવવા પૂછ પૂછ કરે છે અને પંડિતો એટલે નિષ્ણાતો પાસેથી શીખે છે તેમની સમજણ શક્તિ સૂરજનું કિરણ પડતાં જેમ કમળ ખીલી ઊઠે તેમ વિસ્તૃત બને છે.]

यावच्चंद्रदिवाकरौ।

[જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહે ત્યાં સુધી.]

यावत् जीवेत् सुखेन जीवेत् ऋणं कृत्वा धृतं पिबेत् ।  
भस्मीभूतस्य देहस्य पुनरागमनं कुतः ॥

[નાસ્તિકતાવાદી ચાર્વાક ઋષિનું વિખ્યાત સૂત્ર: જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. દેવું કરીને પણ ધી પીઓ એટલે કે થાય તેટલી મજા માણી લો. આ દેહને જ્યારે બાળી નાખવામાં આવે ત્યારે એ પાછો ક્યાંથી આવવાનો છે ? ]

ये च मूढतमाः लोके ये च बुद्धेः परं गताः।  
ते एव सुखम् एधन्ते मध्यमः क्लिश्यते जनः॥

[મહાભારતનું કથન છે. આ જગતમાં બે જ પ્રકારનો લોકો સુખી છે. એક તો જે ખરેખર બુદ્ધિમાન છે, જેમની પાસે સાચું જ્ઞાન છે, સાચી સમજ છે. બીજા એવા લોકો કે જેઓ તદ્દન અબુધ છે, જેમની પાસે તલભાર અક્કલ કે સમજ નથી. દુનિયાના બધા દુઃખનો ભાર આ બે વર્ગની વચ્ચે રહેલા લોકોએ ઉપાડવો રહે છે.]

येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्मः।  
ते मर्त्यलोके भुविभारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति॥

[ જે માણસ પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી, સદાચાર નથી, ગુણ નથી, ધર્મ નથી એનું આ જગતમાં કામ શું છે ? આવા માણસો ધરતી માટે ભારરૂપ છે. ખરી રીતે જોતાં આ લોકો માણસનું રૂપ ધારણ કરી હરતા ફરતા ઢોર જેવાં જ છે.]

यो ध्रुवाणि परित्यज्य अध्रुवं परिषेवते।  
ध्रुवाणि तस्य नश्यन्ति अध्रुवं नष्टमेव च॥

[ભગવદ્ ગીતાનો ઉપદેશ: જે લોકો શાશ્વત સુખને છોડી ક્ષણિક સુખની પાછળ દોડે છે તેમના શાશ્વત સુખ નષ્ટ થાય છે અને ક્ષણિક સુખ તો નષ્ટ થવાના જ છે.]

योगः कर्मसु कौशलम्।

[ભગવદ્ ગીતાનું કથન: જે કાર્ય કરતા હોઈએ તે કુશળતાપૂર્વક કરવું તે યોગ છે.]

यौवनं धनसंपत्तिः प्रभुत्वमविवेकिता।  
एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम्॥

[જોબન ધન ઠાકરી ને વળી ઉમેરણમાં અવિવેકી જાત એકેકું જ અનર્થ કરે ત્યાં ચારની પહોંચે ક્યાં જઈ વાત]



रम्याणि वीक्ष्य मधुरांश् च निशम्य शब्दान्  
पर्युत्सुकी भवति यत् सुखेतेऽपि जन्तुः।  
तच् चेतसा स्मरति नूनम् अबोधपूर्व  
भाव स्थिराणि जननान्तर सौहृदानि॥

(अभिज्ञान शाकुंतलम् अंक - पांचमो)

[निहाणी कशुं रमणीय ने सूणी को निशब्द मीहुं गान  
कदी अलिप्तजनने हैये पण जागे कुतुहलनुं तोडान  
स्मृतिओ उभरे अदीठ अजाणी मनने कंई नव समजाय  
ताशवाणा को पूर्व जनमना जाणे वणाय ने विभराय]

रम्यान्तरः कमलिनीहरितैः सरोभिश्छायाद्रुमैर्नियमितार्कमयूखतापः।  
भूयात्कुशेशयरजोमृदुरेणुरस्याः शान्तानुकूलपवनश्च शिवश्च पन्थाः॥

(अभिज्ञान शाकुंतलम् - अंक योथो)

[मार्ग बने रमणीय तारो भील्या हरित कमल भरेलो  
ताप न पहीये तारा सुधी रहेजो सूर्य वन टोय सूतेलो  
तारा इणवा पदरवथी न उडजो रज जरी ये काणी  
पग नीये पथराई रहेजो वननी अमंड हरियाणी  
वहेजो पवन शांत मजानो हो रस्तो सुभ शांति भरेलो]

राजा राष्ट्रकृतं पापं राज्ञः पापं पुरोहितः।  
भर्ता च स्त्रीकृतं पापं शिष्यपापं गुरुस् तथा॥

[ जो अेक देश के राष्ट्र भोटुं काम करे तो तेनो राजा भरो गुनेगार गणाय. जो राजा भोटुं काम करे तो  
तेना सलाइकार के मंत्रीओ भरा गुनेगार छे. स्त्री भोटुं काम करे तो तेनो पति सायो अपराधी छे अने  
जो शिष्य पाप करे तो ते पाप माटेनी बधी जवाबदारी तेना गुरुनी छे.]

रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः।  
इत्थं विचिन्तयति कोषगते द्विरेफे हा हन्त हन्त नलिनीं गज उज्जहार॥

[સાંજ પડ્યે કમળનું પુષ્પ બીડાઈ જતાં રસનો લોભી ભમરો અંદર કેદ થઈ જાય છે અને વિચાર કરે છે કે રાત પૂરી થઈ જશે, સુંદર સવાર પડશે, સૂર્ય ઊગશે, કમળ હસતું હસતું ખીલશે પણ અરેરે, ત્યાં હાથી આવીને કમળને ઉખાડી ફેંકી દે છે. આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે આપણાં સપનાઓ અને જીવનની કડવી વાસ્તવિકતા તદ્દન જુદા હોય એવું પણ બને છે.]

૧

लभेत सिकतासु तैलमपि यत्रतः पीडयन्  
पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः।  
कदाचिदपि पर्यटन् शशविषाणमासादयेत्  
न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्॥

[ખૂબ મહેનત કરીએ તો કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય, શક્ય છે કે તરસ્યો મુસાફર મૃગજળનું પાણી પી શકે, કદાચ ફરતાં ફરતાં કોઈ સસલાને માથે શિંગડાં ઊગેલા જોવા મળે પરંતુ ગમે તે કરવા છતાં મૂરખ માણસને ખુશ ન કરી શકાય.]

लालयेत् पंचवर्षाणि दशवर्षाणि ताडयेत्।  
प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत्॥

[સંતાન પ્રથમ પાંચ વર્ષ સુધી લાડકોડનું અધિકારી ગણાય તેને તેની ભૂલની કોઈ સજા ન હોય. પછીના દશ વર્ષ સુધી તેને નિયમપાલનનું મહત્વ સમજાવવું રહે છે અને તેનું ખોટું વર્તન સજાપાત્ર બને છે. પણ સંતાન જ્યારે સોળ વર્ષનું થાય ત્યારે મા-બાપે તેને મિત્રનો દરજ્જો આપવો જોઈએ.]

लोभाविष्टो नरो वित्तम् वीक्ष्यते न तु संकटम्।  
दुग्धं पश्यति मार्जारी न तथा लगुडाहतिम्॥

[લાલચમાં લપટાઈ ગયેલા માણસને પૈસા દેખાય છે પણ સંકટ દેખાતું નથી બિલાડીને દૂધ દેખાય છે પણ હાથમાં રહેલી લાકડી દેખાતી નથી.]

૧

વજ્રાદપિ કઠોરાણિ મૃદ્નિ કુસુમાદપિ।  
લોકોત્તરાણાં ચેતાંસિ કો હિ વિજ્ઞાતુર્મર્હતિ॥

[વજ્રથી વધુ કઠોર અને પુષ્પથી પણ વધુ કોમળ એવા મહાપુરુષોના મનમાં શું હોય તે કોણ સમજી શકે ?]

વનાનિ દહતો વહે સખા ભવતિ મારુતઃ।  
સ એવ દીપનાશાય કૃશે કસ્યસ્તિ સુહૃદમ્॥

[પવન વનમાં જોરદાર સળગતા અગ્નિનો મિત્ર બને છે. તેને ટેકો આપે છે, મદદ કરે છે. તે જ પવન નાના સળગતા દીવડાને બૂઝાવી નાખે છે. નબળાનું મિત્ર કોણ બને ?]

વનેઽપિ સિંહા મૃગમાંસભક્ષિણો બુભુક્ષિતા નૈવ તૃણં ચરન્તિ।  
એવં કુલીના વ્યસનાભિભૂતા ન નીચકર્માણિ સમાચરન્તિ ॥

[સિંહને ગમે તેટલી ભૂખ લાગે પણ તે ઘાસ ખાતો નથી. વનમાં રહીને માત્ર હરણનો આહાર કરે છે. સુસંસ્કારી માણસો પોતાને શોભે નહિ તેવું કામ સંકટકાળમાં પણ ન કરે.]

વયમિહ પરિતુષ્ટા વલ્કલૈસ્ત્વં દુકૂલૈઃ  
સમ્મ ઇહ પરિતોષો નિર્વિશેષો વિષેશઃ।  
સ તુ ભવતુ દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા  
મનસિ ચ પરિતુષ્ટે કોઽર્થવાન્ કો દરિદ્રઃ॥

[સંન્યાસી રાજાને કહે છે: અમે વલ્કલ પહેરીને સંતુષ્ટ છીએ. તું કિંમતી વસ્ત્રો ધારણ કરીને અમારો સંતોષ તારા જેટલો જ છે. મનની ઇચ્છાઓની વણઝાર જ માણસને ગરીબ બનાવે છે. જેનું મન સંતોષી હોય તેને માટે ગરીબાઈ કે શ્રીમંતાઈ એવા શબ્દોનો કોઈ અર્થ નથી.]

वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये।  
जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥

[‘रघुवंश’નો પ્રથમ શ્લોક. આખું થોથું લખી શકાય તેટલી વાત મહાકવિ કાલિદાસે બે પંક્તિમાં કહી છે. વાણી અને તેના અર્થની જેમ એક બીજાથી અલગ છતાં વાણી અને તેના અર્થની માફક એક બીજામાં ઓતપ્રોત થઈ ગયેલા, હે જગતના માત-પિતા પાર્વતી-પરમેશ્વર, તમને વંદન હો. વાણી અને તેના અર્થનું ભિન્નપણું અને અભિન્નપણું સમજાવતો આવો શ્લોક કાલિદાસ જ લખી શકે.]

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।  
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही॥

[શ્રીમદ્ ભગવત ગીતાનો સૌથી વધુ સચોટ દાખલો આપતો શ્લોક. જેમ માણસો જૂના થઈ ગયેલા કપડા છોડી દઈ નવા કપડાં પહેરે છે તેમ આત્મા પણ જૂનું શરીર છોડી નવો દેહ ધારણ કરે છે.]

विकृतिं नैव गच्छन्ति संगदोषेण साधवः।  
आवेष्टितं महासर्पैश्चंदनं न विषायते॥

[જેમ મહાસર્પથી વીંટળાયેલું ચંદનનું વૃક્ષ ઝેરી બની જતું નથી તેમ ખરો સાધુ સંગદોષ કરે તો પણ વિકૃત બનતો નથી.]

विजेतव्या लङ्का चरणतरणीया जलनिधिः  
विपक्षः पौलस्त्यो रणभुवि सहायाश्च कपयः।  
तथाप्येको रामः सकलमवधीद्राक्षसकुमम्  
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥

[લંકા પર વિજય મેળવવાનો હતો, પગેથી ચાલીને દરિયો પાર કરવાનો હતો, પુલસ્ત્ય ઋષિના પુત્ર રાવણ સાથે લડવાનું હતું, મદદમાં માત્ર વાનરસેના હતી. આમ છતાં એકલા રામ સમગ્ર રાક્ષસકુળનો નાશ કરી શક્યા. કામની સફળતા બહારના સાધનો પર નહિ પણ આપણી અંદરની તાકાત પર આધાર રાખે છે.]

विदेशेषु धनं विद्या व्यसनेषु धनं मतिः।  
परलोके धनं धर्मः शीलं सर्वत्र वै धनम्॥

[परदेशમાં આપણું ખરું ધન વિદ્યા બને છે. સંકટકાળમાં સુબુદ્ધિ આપણું ધન બને છે. પરલોકમાં ધર્મ આપણી સંપત્તિ બને છે. સદાચાર સર્વત્ર સંપત્તિરૂપ પુરવાર થાય છે.]

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं  
विद्या भोगकरी यशः सुखकरी विद्या गुरुणां गुरुः॥  
विद्या बन्धुजनो विदेशगमने विद्या परा देवता  
विद्या राजसु पूज्यते न हि धनं विद्याविहीनः पशुः॥

[વિદ્યા માણસની સૌથી મોટી સુંદરતા છે. વિદ્યા ખૂબ સલામત એવું અપ્રગટ ધન છે. વિદ્યા સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખ લઈ આવે છે. વિદ્યા ગુરુની ગુરુ છે. પરદેશમાં વિદ્યા સગા ભાઈની જેમ મદદ કરે છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓ પણ ધનની નહિ વિદ્યાની પૂજા કરે છે. વિદ્યા વિનાનો માણસ સાક્ષાત પશુ સમાન છે.]

विद्या विवादाय धनं मदाय खलस्य शक्तिः परपीडनाय।  
साधोस्तु सर्वं विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय॥

[દુર્જન માણસ વિદ્યાનો ઉપયોગ વિવાદ કરવા માટે, ધનનો ઉપયોગ અભિમાન કરવા માટે અને શક્તિનો ઉપયોગ બીજાને ત્રાસ આપવા માટે કરે છે. સજ્જનોનું તેથી ઊલટું વર્તન હોય છે. તેઓ વિદ્યા જ્ઞાન માટે, ધન દાન માટે અને શક્તિ રક્ષણ કરવા માટે ઉપયોગમાં લે છે.]

विद्वत्त्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन।  
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते॥

[વિદ્વતાની અને રાજવીપણાંની સરખામણી ન થઈ શકે. રાજા માત્ર તેના રાજમાં પૂજાય પણ વિદ્વાન માણસ તો જ્યાં જાય ત્યાં પૂજાય.]

विषादप्यमृतं ग्राह्यं बालादपि सुभाषितम्।  
अमित्रादपि सद्वृत्तं अमेध्यादपि कांचनम्॥

[ઝેરમાંથી અમૃત મળતું હોય તે લઈ લેવું જોઈએ, એક નાના બાળક પાસેથી પણ જો કોઈ બોધવાક્ય સાંભળવા મળે તો તેનો સ્વીકાર કરી લેવો જોઈએ, દુશ્મન પાસેથી પણ સદ્ગુણ ગ્રહણ કરવા મળે તો ગ્રહણ કરી લેવા જોઈએ. સોનું કચરાની વચ્ચે પડ્યું હોય તો પણ તેને તરછોડાય નહિ.]

वीरभोग्या वसुन्धरा।

[જમીનનો ભોગવટો બહાદૂર માણસ જ કરી શકે. ધરતીના ધણી થવું ખાવાનો ખેલ નથી.]

वृथा वृष्टिः समुद्रेषु वृथा तृप्तेषु भोजनम्।  
वृथा दानं धनाढ्येषु वृथा दीपो दिवाऽपि च॥

[દરિયામાં વરસાદ પડે તે નકામો જાય. જેનું પેટ ભરેલું છે તેને ખવડાવવાનો કોઈ અર્થ નથી. જેની પાસે ધનના ઢગલા હોય તેને દાન આપવાથી શું વળે ? જ્યાં ખૂબ અજવાળું હોય ત્યાં દીવા ન સળગાવાય.]

वृश्चिकस्य विषं पृच्छे मक्षिकायाः मुखे विषम्।  
तक्षकस्य विषं दन्ते सर्वांगे दुर्जनस्य तत्॥

[વીંછીનું ઝેર એની પૂંછડીમાં હોય છે. માખીના મોઢામાં ઝેર હોય છે, સાપના દાંતમાં ઝેર હોય છે પણ દુર્જનના દરેકેદરેક અંગમાં ઝેર ભરેલું હોય છે.]

वैद्यराज नमस्तुभ्यं यमराजसहोदर।

यमस्तु हरति प्राणान् वैद्यो प्राणान् धनानि च॥

[યેતવણી: નબળું હૃદય ધરાવતા દાકતરોએ આ જોખમી પ્રાચીન સુભાષિત વાંચવું નહિ! હે વૈદરાજ, તને પગે લાગીએ છીએ. તું આમ તો જમરાજનો ભાઈ છે પણ જમરાજ કરતાં ક્યાંય ચડી જાય તેવો છે. જમરાજ તો માત્ર પ્રાણ લઈને ચાલતા થાય છે પણ તું તો અમારો પ્રાણ અને પૈસા બન્ને લીધા પછી જ અમને છોડે છે !]

वाक्यं रसात्मकं काव्यम्।

[કવિતાની સૌથી ટૂંકી ને સૌથી અસરકારક વ્યાખ્યા. રસથી સભર વાક્ય એટલે કાવ્ય.]

व्यापारे वसते लक्ष्मी।

[ચીજવસ્તુની આપ-લે કરવાથી સમૃદ્ધિ સર્જાય છે.]

व्यासोच्छिष्टं जगत् सर्व।

[જગત આખું વ્યાસના મોંમાંથી બહાર આવ્યું છે. મહાભારત મહાકાવ્ય રચનાર વ્યાસ મુનિની પ્રશંસા માટે આ વાક્ય કહેવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો છે કે તત્વજ્ઞાન અને માનવ સંબંધનો એકેય વિષય એવો નથી કે જેની મહાભારતમાં ચર્ચા છણાવટ ન થઈ હોય. આથી હવે જગતમાં કદી ન ઉપસ્થિત કરવામાં આવી હોય તેવી એક પણ વાત રહી નથી.]

श।

शठे शाठ्यं समाचरेत्।

[બીજાને છેતરનારાને છેતરવો એ જ સાચો ઉપાય છે.]

शतेषु जायते शूरः सहस्रेषु च पंडितः।

वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा॥

[દર સો માણસે એકાદ શૂરવીર મળી આવે. એક હજાર માણસે એકાદ જાણકાર પંડિત મળે. દશ હજાર માણસોમાંથી એકાદ સારો વક્તા પાકે. પણ દાતા તો ગમે તેટલું શોધો, જવલ્લે જ મળે.]

शान्तितुल्यं तपो नास्ति तोषान्न परमं सुखम्।

नास्ति तृष्णापरो व्याधिर्न च धर्मो दयापर॥

[શાંતિ સમાન કોઈ તપ નથી. સંતોષ સમાન કોઈ સુખ નથી. તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ નથી અને દયા સમાન કોઈ ધર્મ નથી.]

शिरः शार्वं स्वर्गात्पततिशिरसस्तत् क्षितिधरं  
महीधादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम्।  
अधोऽधो गङ्गेयं पदमुपगता स्तोकमथवा  
विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः॥

[स्वर्गमांथी ઉતરેલી પવિત્ર ગંગા શંકર ભગવાનની જટા પર પડે છે. ત્યાંથી હિમાલયના પહાડો પર અને પછી પડતી પડતી સપાટ મેદાનોમાં જઈ છેવટે સમુદ્રમાં વિલીન થઈ જાય છે. આમ ગંગા નદી એક વખત નીચે પડ્યા પછી વધુ ને વધુ નીચે પડતી જાય છે. એવું જ માણસોનું છે. એક વખત સાનભાન ચૂકો પછી તમારું સેંકડો રીતે અધપતન થાય છે.]

शुचिर्दक्षोऽनुरक्तश्च भृत्यः खलु सुदुर्लभः।

[સ્વચ્છતા જાળવવામાં કુશળ હોય અને સાથે સાથે માલિકની પ્રેમથી સેવા કરે તેવા નોકર નસીબ હોય તો જ મળે.]

शुभस्य शीघ्रं।

[સારું કામ ઝપાટાભેર કરવું જોઈએ. તેમાં કોઈની રાહ ન જોવાય.]

शुभास्ते पन्थानः संतु।

[તારો પંથ શુભ બનો.]

शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे।

साधवो न हि सर्वत्र चन्दनं न वने वने॥

[દરેક પર્વત પર માણિક્ય ન હોય. દરેક હાથીના કપાળમાં મોતી ન હોય. બધે જ સારા માણસ ન હોય, દરેક જંગલમાં ચંદનના ઝાડ ન હોય. હિતોપદેશનો આ શ્લોક કેટલો સરળ અને છતાં સાચો છે !]



## સ

સંગ્રહૈકપરઃ પ્રાયઃ સમુદ્રોપિ રસાતલે।  
દાતારં જલદં પશ્ય ગર્જન્તં ભુવનોપરી॥

[દરિયાને માત્ર પાણી ભેગું કરતા આવડે છે બીજાને આપતા આવડતું નથી એટલે તેનું સ્થાન રસાતાળ ગયું છે. જુઓ પાણીનું દાન કરતાં વાદળા ભુવનમાં સર્વોપરી સ્થાને બેસીને કેવી ગર્જના કરે છે !]

સત્યં બ્રૂયાત્ પ્રિયં બ્રૂયત્ ન બ્રૂયાત્ સત્યમપ્રિયં।  
પ્રિયં ચ નાનૃતં બ્રૂયાત્ ણ ધર્મઃ સનાતનઃ॥

[સત્ય બોલવું જોઈએ પ્રિય બોલવું જોઈએ અપ્રિય હોય તેવું સત્ય બોલવાનું ટાળવું જોઈએ અને અસત્ય પ્રિય લાગે તેવું હોય છતાં કદી ન બોલવું એ સનાતન નિયમ છે.]

સત્યં વદ ધર્મં ચર સ્વાધ્યાયાન્મા પ્રમદઃ।  
આચાર્યાય પ્રિયમ્ ધનમાહૃત્ય પ્રજાતંતુમ્ મા વ્યવચ્છેત્સીઃ ॥

[તૈત્તરીય ઉપનિષદમાં નવા વિદ્યાર્થીને ઉપદેશઃ સાચું બોલજે, ધર્મ પ્રમાણે આચરણ કરજે. પોતાના અભ્યાસમાં તલલીન રહેજે. ગુરુને દક્ષિણા આપજે અને આ પરંપરાનો લોપ ન થાય તેનું ધ્યાન રાખજે.]

સત્યમેવ જયતે નાનૃતમ્।

[વિજય સત્યનો થાય છે, જુઠનો નહિ. આપણા દેશનો આ મુદ્રાલેખ છે.]

સત્યસ્ય વચનં શ્રેયઃ સત્યાદપિ હિતંવદેત્।  
યદ્ભૂતહિતમત્યન્તં એતત્ સત્યં મતં મમ॥

[નારદ મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. મારા મતે જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે.]

सदा वक्रः सदा क्रूरः सदापूजामपेक्षते।  
कन्याराशिस्थितो नित्यं जामाता दशमोग्रहः॥

[જમાઈ નામનો દશમો ગ્રહ કાયમ માટે કન્યા રાશિમાં રહે છે, સદા વાંકો ચાલે છે, કાયમ ફૂર સ્વભાવ ધરાવે છે અને હંમેશા પોતાની પૂજા થવી જોઈએ એવી ઇચ્છા ધરાવે છે !]

सन्तुष्टो भार्यया भर्ता भर्त्रा भार्या तथैव च।  
यस्मिन् एव कुले नित्यं कल्याणं तत्र वै ध्रुवम्॥

[મનુસ્મૃતિનું માર્ગદર્શન: જે ઘરમાં પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ હોય અને પત્ની પોતાની પતિથી તે ઘરમાં હંમેશા સુખનું સામ્રાજ્ય રહે છે.]

सम्पूर्णकुम्भो न करोति शब्दं अर्धो घटो घोषमुपैति नूनं।  
विद्वान् कुलीनो न करोति गर्वं मूढास्तु जल्पन्ति गुणैर्विहीनाः॥

[પાણીથી પૂરો ભરેલો ઘડો અવાજ કરતો નથી. અર્ધો ભરેલા ઘડામાંથી ઘણો અવાજ આવે છે. વિદ્વાન અને કુલીન માણસો ગર્વ કરતા નથી. ગુણ વિનાના માણસો બડબડ કરતા રહે છે.]

सर्पः क्रूरः खलः क्रूरः सर्पात् क्रूरतरः खलः।  
सर्पः शाम्यति मन्त्रैश्च दुर्जनः केन शाम्यति॥

[સર્પ ફૂર છે, દુર્જન પણ ફૂર છે. પણ સાપ કરતાં દુર્જન વધુ ફૂર લેખાય કેમકે સાપને તો મંત્રોથી વશ કરી શકાય છે. દુર્જનને કોઈ રીતે અંકુશમાં લાવી શકાય નહિ.]

सर्पदुर्जनयोर्मध्ये वरं सर्पो न दुर्जनः।  
सर्पो दशति कालेन दुर्जनस्तु पदे पदे॥

[સાપ અને દુર્જન એ બન્નેની તુલના કરીએ તો દુર્જન કરતાં સાપ વધુ સારો ગણાય કેમકે સાપ તો કોઈક વખત કરડે છે પણ દુર્જન ડગલે ને પગલે ડંખ મારતો જ રહે છે.]

सर्वनाशे समुत्पन्ने ह्यर्थं त्यजति पण्डितः।  
अर्थेन कुरुते कार्यं सर्वनाशो हि दुःसहः॥

[જ્યારે સર્વનાશ સામે આવે ત્યારે ડાહ્યો માણસ અડધું છોડી દે છે કેમકે અડધાથી જેમ તેમ કામ ચલાવી લેવાય પણ સર્વનાશ સહન કરવો બહુ ભારે પડે.]

स्वभावो नोपदेशेन शक्यते कर्तुमन्यथा।  
सुतसमपि पानीयं पुनर्गच्छति शीतताम्॥

[સલાહ કે ઉપદેશથી કોઈનો સ્વભાવ બદલાવી શકાતો નથી. પાણીને ગરમ કરો તેટલી વખત ગરમ રહે પણ જેવું નીચેનું તાપણું દૂર થાય કે પાછું હતું તેવું ને તેવું થઈ જાય.]

सामदाने भेददण्डावित्युपायचतुष्टयम्।  
हस्त्यश्च रथ पादातिं सेनाङ्गं स्यात् चतुष्टयम्॥

[રાજા પાસે શાસન ચલાવવા માટે સામ, દામ, ભેદ, દંડ એમ ચાર ઉપાય હોવા જોઈએ અને હાથી, ઘોડા, રથ, અને પાદાટી એમ ચાર પ્રકારની શક્તિ ધરાવતું સૈન્ય હોવું જોઈએ.]

सामर्थ्यमूलं स्वातन्त्र्यं श्रममूलं च वैभवम्।  
न्यायमूलं सुराज्यं स्यात् संघमूलं महाबलम्॥

[સામર્થ્ય એ સ્વતંત્રતાના મૂળમાં છે. તમારી પાસે તમારી પોતાની તાકાત ન હોય તો તમે સ્વતંત્ર ન રહી શકો. શ્રમ એ સમૃદ્ધિનું મૂળ છે. મહેનત કર્યા વિના ન સમૃદ્ધિ મળે ન ટકે. સુરાજ્યના મૂળમાં ન્યાય છે. ન્યાય વિના સુરાજ્ય ટકી ન શકે. મહાશક્તિના મૂળમાં સંપ અને સંગઠન છે. જ્યાં સંઘ હોય એટલે કે સંપ-સંગઠન હોય ત્યાં જ પ્રચંડ શક્તિ ઉદ્ભવે.]

साहसे श्रीः प्रतिवसति।

[જે સાહસ કરે તેને લક્ષ્મી મળે.]

साहित्यसङ्गीतकलाविहीनः साक्षात्पशुः पुच्छविषाणहीनः।  
तृणं न खादन्नपि जीवमानः तद्भागधेयं परमं पशूनाम्॥

[ભર્તૃહરિ કૃત નીતિશતકના આ લોકપ્રિય શ્લોક અનુસાર જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ છે. પશુઓનું એ સદ્ભાગ્ય છે કે આવા લોકો ઘાસ ખાધા વિના જીવી શકે છે !]

સાક્ષરાઃ વિપરીતાશ્ચેત્ રાક્ષસાઃ એવ કેવલમ્।  
સરસો વિપરીતશ્ચેત્ સરસત્વં ન મુચ્ચતિ॥

[‘સાક્ષરા’ શબ્દને ઊલટો કરીએ તો તે ‘રાક્ષસા’ બની જાય છે. ‘સરસ’ શબ્દને ઊલટાવીએ તો પણ તે ‘સરસ’ જ રહે. તે કદી પોતાનું સરસપણું ન છોડે.]

સુખં હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાન્ધકારેષ્વિવ દીપદર્શનમ્।  
સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતાં ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતિ॥

[ગાઢ અંધકારની અંદર જેમ દીપક શોભે છે તેમ સુખ પણ દુઃખની અનુભૂતિથી વધુ સુંદર લાગે છે. પણ જે લોકો સુખમાંથી ગરીબાઈના નર્કમાં આવી ચડે છે તે ભલે શરીરથી જીવતા રહે પણ મૃતપ્રાયઃ બની જાય છે.]

સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ।  
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ॥

[ગીતામાં ભગવાનનો ઉપદેશ. સુખ દુઃખને સમાન ગણીને, લાભ હાનિ તથા જય પરાજયમાં અવિચલિત રહીને કર્તવ્યના પાલન તરીકે યુદ્ધ કરવામાં જોડાઈ જાઓ. આવું કર્તવ્યપાલન તમને પાપી નહિ બનાવે.]

સુખમાપતિતં સેવ્યં દુઃખમાપતિતં તથા।  
ચક્રવત્ પરિવર્તન્તે દુઃખાનિ ચ સુખાનિ ચ॥

[જીવનમાં જ્યારે સુખ આવે ત્યારે તેને માણી લેવું, દુઃખ આવે ત્યારે તેને પણ વધાવી લેવું. સુખદુઃખનું ચક્ર સદા ચાલતું જ રહેવાનું છે.]

सुखस्यानन्तरं दुःखम् दुःखस्यानन्तरं सुखम्।  
न नित्यं लभते दुःखं न नित्यं लभते सुखम्॥

[सुખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે. કોઈને રોજરોજ સુખ ન મળે કે કોઈને રોજરોજ દુઃખ ન મળે.]

सुखार्थी वा त्यजेत विद्या विद्यार्थी वा त्यजेत सुखम्।  
सुखार्थिनः कुतो विद्या विद्यार्थिनः कुतो सुखम्॥

[વિદ્યાપ્રાપ્તિ છોડી સુખની પાછળ ભાગવું કે સુખને છોડી વિદ્યાપ્રાપ્તિ પાછળ પાગલ બનવું બન્ને એકાંગી માર્ગ છે. આ રીતે જેને સુખ જોઈતું હોય તેને કદી વિદ્યા ન મળે અને માત્ર વિદ્યા પાછળ દોડનાર કદી સુખી ન બની શકે.]

सुलभाः पुरुषा राजन् सततं प्रियवादिनः।  
अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभः॥

[વાલ્મિકી રામાયણ અરણ્યકાંડ શ્લોક ૩૭-૨. હે રાજન્ સતત મીઠું મીઠું બોલનારા માણસો સહેલાઈથી મળી આવે છે પણ કડવી છતાં હિતની વાત કરનારા અને સાંભળનારા આ જગતમાં બહુ ઓછા છે.]

सूतो वा सूतपुत्रो वा यो वा को वा भवाम्यहम्।  
दैवायतं कुले जन्म मदायतं तु पौरुषम्॥

[મહાભારતમાં કર્ણ આ શ્લોક બોલે છે અને કહે છે કે ભલે હું સામાન્ય રથ હાંકનાર હોઉં કે રથ હાંકનારનો પુત્ર હોઉં કે ગમે તે હોઉં. આ બધી વાત ક્ષુલ્લક છે. ક્યા કુળમાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. મારા હાથની વાત તો મારું સાહસ અને પરાક્રમ છે.]

स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः।  
इति विज्ञाय मतिमान् स्वस्थानं न परित्यजेत्॥

[દાંત, વાળ, નખ અને પુરુષ પોતાનું સ્થાન ગુમાવી દે પછી શોભતા નથી એ વાત ધ્યાનમાં રાખી ડાહ્યા માણસોએ પોતાના સ્થાન પર સ્થિર રહેવું જોઈએ.]

स्यात् कज्जलं सिन्धु पात्रं  
सुरतरुवरशाखा लेखनी पत्रमुर्वी।  
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं  
तदापि तव गुणानां ईश पारं न याति॥

[દરિયો ભરીને શાહી લઈ વૃક્ષની ડાળીની કલમ બનાવી ખૂદ શારદા માતા સદાકાળ લખ્યા કરે તો પણ હે ભગવાન તારા ગુણોનો પાર ન આવે.]

શ્રુતિ વિભિન્ના સ્મૃતયોઽપિ ભિન્નાઃ  
નૈકો મુનિ ર્યસ્ય વચઃ પ્રમાણમ્।  
ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયામ્  
મહાજનો યેન ગતઃ સ પન્થાઃ॥

[શ્રુતિ અલગ અલગ કહે છે, સ્મૃતિઓમાં પણ જુદી જુદી વાત છે. કોઈ એક એવા મુનિ નથી કે માત્ર તેના વચનને જ પ્રમાણ માનીને ચાલી શકાય. ધર્મનું તત્ત્વ ગૂઢ છે - સહેલાઈથી સમજી શકાય તેવું નથી. આથી મોટા માણસો જે રસ્તે ચાલે તે રસ્તો સાચો છે એમ માનીને આપણે પણ તે રસ્તે ચાલવું.]

શ્રોત્રં શ્રુતેનૈવ ન કુણ્ડલેન દાનેન પાણિર્ન તુ કઙ્કણેન।  
વિભાતિ કાયઃ કરુણાપરાણાં પરોપકારૈર્ન તુ ચન્દનેન॥

[કાન કુંડળ વડે નહિ પણ જ્ઞાનની વાત સાંભળવાથી શોભે છે. હાથ કંકણ વડે નહિ પણ દાન વડે શોભે છે. કાયા પણ ચંદનના લેપ વડે નહિ પણ કરુણામય પરોપકાર વડે કાંતિમાન બને છે.]

સ્વધર્મે નિધનમ્ શ્રેયમ્ પરધર્મો ભયાવહઃ।

[ભગવત ગીતાના આ ઉપદેશનું અનેક રીતે અર્થઘટન કરવામાં આવે છે. એ બધી ચર્ચાનો સાર એ છે કે આપણને પોતાને જે ઠીક લાગે, સાચું લાગે તે કરવું અને તેમાં મરણ આવે તો પણ મનને સંતોષ થશે. પણ બીજાના દોરવાયા દોરાતા રહીને પોતાની અંદરથી આવતો અવાજ ન સાંભળવો તે વાત ભયંકર છે. ]

स्वाभिमानो धनंयेषां चिरजीवन्ति ते जनाः।  
स्वाभिमानविहीनानां किं धनेन किमायुषा॥

[જેમની પાસે સ્વાભિમાનરૂપી સંપત્તિ છે તે માણસો શાશ્વત જીવે છે. જેમની પાસે સ્વાભિમાન નથી તેમની પાસે ધન કે આયુષ્ય હોય તો પણ શું કામનું ? ]

૫

षट्पदः पुष्पमध्यस्थो यथा सारं समुद्धरेत्।  
तथा सर्वेषु शास्त्रेषु सारं गृह्णन्त पण्डिताः॥

[જેમ ભમરો દરેક પુષ્પ પર જઈ તેનું ઉત્તમ તત્વ એકઠું કરે છે તેમ ડાહ્યા માણસે દરેક શાસ્ત્ર વાંચી તેનો સાર મગજમાં ઉતારવો જોઈએ.]

૬-૭

हंसः श्वेतो बकः श्वेतो को भेदो बकहंसयोः।  
नीरक्षीरविवेके तु हंसः हंसो बको बकः॥

[હંસ સફેદ દેખાય છે. બગલો પણ સફેદ દેખાય છે. પરંતુ જ્યારે પાણી અને દૂધ અલગ કરવાની વાત આવે ત્યારે હંસ હંસ જેવો અને બગલો બગલા જેવો સાબિત થઈ જાય છે.]

हीयते हि मतिस्तात् हीनैः सह समागतात्।  
समैस्च समतामेति विशिष्टैश्च विशिष्टितम्॥

[મહાભારતનો શ્લોક છે: હીન એટલે કે અધમ માણસો સાથે રહેવાથી આપણી બુદ્ધિ અધમ થઈ જાય છે. સમાન માણસો સાથે રહેવાથી સમાન રહે છે અને વિશિષ્ટ એટલે કે ખૂબ પ્રતિભાવાન સાથે રહેવાથી આપણી પ્રતિભા પણ ખિલે છે.]

ક્ષ

ક્ષણશઃ કણશ્ચૈવ વિદ્યામ્ અર્થં ચ સાધયેત્।  
ક્ષણે નષ્ટે કૃતો વિદ્યા કણે નષ્ટે કૃતો ધનમ્॥

[પ્રત્યેક ક્ષણનો ઉપયોગ કરી વિદ્યા મેળવવી જોઈએ અને પ્રત્યેક કણ બચાવી ધન એકઠું કરવું જોઈએ. ક્ષણ વેડફે વિદ્યા ન મળે, કણ વેડફે ધન ન મળે.]

ક્ષણે તુષ્ટઃ ક્ષણે રુષ્ટસ્તુષ્ટો રુષ્ટઃ ક્ષણે ક્ષણે।  
અવ્યવસ્થિતચિત્તસ્ય પ્રસાદોઽપિ ભયઙ્કરઃ॥

[ઘડીક ખુશ તો ઘડીક નાખુશ. એક ઘડી રાજી તો બીજી મિનિટે અગનગોળો. જેમના મગજનું કંઈ ઠેકાણું ન હોય તેમની મહેરબાની પણ ભારે પડી જાય.]

ક્ષણેક્ષણે યદ્ નવતાં ડપૈતિ સ રૂપઃ।

[કાલિદાસે કરેલી સૌંદર્યની વ્યાખ્યા: ખરી સુંદરતા તેને કહેવાય જે હરઘડી નવું રૂપ ધારણ કરે.]

ક્ષમા બલમશક્તાનામ્ શક્તાનામ્ ભૂષણમ્ ક્ષમા।  
ક્ષમા વશીકૃતે લોકે ક્ષમયા કિં ન સિધ્યતિ॥

[ક્ષમા શક્તિશાળી માણસનું સાચું બળ છે. શક્તિશાળી માણસો ક્ષમા વડે શોભે છે. ક્ષમાથી લોકો વશ થઈ જાય છે. ક્ષમાથી શું ન થઈ શકે ?]

ક્ષમા શસ્ત્રં કરે યસ્ય દુર્જનઃ કિં કરિષ્યતિ।  
અતૃણે પતિતો વહ્નિઃ સ્વયમેવોપશામ્યતિ॥

[જેમની પાસે ક્ષમા નામનું અમોઘ શસ્ત્ર હોય તેનું કોઈ કંઈ બગાડી શકે નહિ. જે ધરતી તણખલા વિનાની એટલે કે ઉજ્જડ અને વેરાન હોય તેની ઉપર આગનો ગોળો પડે તો તે આપમેળે ઠંડો પડી જાય.]



३

ज्ञानं तु द्विविधं प्रोक्तं शाब्दिकं प्रथमं स्मृतम्।  
अनुभवाख्यं द्वितीयं तु ज्ञानं तदुर्लभं नृप॥

[ज्ञान બે પ્રકારના હોય છે. એક તો શબ્દો વડે મેળવેલું અને ગોખીને યાદ રાખેલું જ્ઞાન અને બીજું સ્વાનુભવ થવાથી સમજાવેલું જ્ઞાન. હે રાજા, આ બીજા પ્રકારનું જ્ઞાન દુર્લભ છે.]

---